

**FREE** **Vastu Consultancy, Music, Epics, Devotional Videos  
Educational Books, Educational Videos, Wallpapers**

\*\*\*\*

All Music is also available in **CD** format. **CD Cover** can also be print with your Firm Name

\*\*\*\*

We also provide this whole Music and Data in **PENDRIVE** and **EXTERNAL HARD DISK**.

Contact : Ankit Mishra ( +91-8010381364, dwarkadheeshvastu@gmail.com )

# KATHOPANISHAD- GUJRATI

આ નું કે મુ

પહેલો અંદ્રાય

પહેલી વણી

વાજશ્વરસતું દાના	...	...	...	૧૩
નચિકેતાની શંકા	...	—	...	૧૪
પિતા-પુત્ર સંવાદ	...	...	...	૧૫
યમલોકમાં નચિકેતા	...	—	...	૧૬
યમરાજનું વરાદાન	...	...	...	૨૧
પ્રથમ વર-પિતૃપુરિતોષ	...	...	...	૨૨
સુવર્ગસ્વરંપ પ્રદર્શન	...	...	...	૨૪
ખીજું વરદાન-સુવર્ગના સાધનરંપ અભિનવિધા				૨૫
નાચિકેત અભિનયનતું ઝળ	...	...	...	૨૬
ગ્રીજું વરદાન-આત્મરહસ્ય	...	...	...	૩૩
નચિકેતાની સ્થિરતા	...	...	...	૩૬
યમરાજનું પ્રદેશન	...	...	...	૩૭
નચિકેતાની નિષ્કામતા	...	...	...	૪૦

## ભીજ વદ્ધી

શ્રેય—પ્રેયવિવેક	...	...	...	૪૫
આવિધામાં ઇસાયેલાઓની દુર્દીશા	...	...	...	૪૬
આત્મજ્ઞાનની હુલ્લાભતા	...	...	...	૪૭
કુમદ્દીણની અનિત્યતા	...	...	...	૪૮
નાચિદેતાના ત્યાગની પ્રશંસા	...	...	...	૪૯
આત્મજ્ઞાનનું રૂળી	...	...	...	૫૦
સર્વથી અતીત વસ્તુવિષયનો પ્રશ્ન	...	...	...	૫૧
ॐકારનો ઉપદેશ	...	...	...	૫૨
આત્મસ્વરૂપનિહિપણુ	...	...	...	૫૩
આત્મા આત્મકૃપાથી સાધ્ય છે	...	...	...	૫૪
આત્મજ્ઞાનનો અનાધિકારી	...	...	...	૫૦

## ત્રીજ વદ્ધી

પ્રામ થનારા અને પ્રામદ્ય ભેદથી ઐ આત્મા	...	...	...	૭૩
અવિવેકની વિવશતા	...	...	...	૭૪
વિવેકાની સ્વાધીનતા	...	...	...	૭૮
અવિવેકાને સંસારપ્રાપ્તિ	...	...	...	૭૯
વિવેકાને પરમ પદની પ્રાપ્તિ	...	...	...	૮૦
વિષય વગેરેની ઈદ્રિયો કરતાં અન્ધતા	...	...	...	૮૧
આત્મા સુક્ષમખુદ્દ્ધિગ્રાસ્ય	...	...	...	૮૪
ઉદ્ઘોધન	...	...	...	૮૫
નિર્વિશેષ આત્મજ્ઞાનથી અમૃતત્વની પ્રાપ્તિ...	...	...	...	૮૮
પ્રસ્તુતગુવિશાનનો ભહિમા	...	...	...	૯૦

# ખીજે અધ્યાય

## પહેલી વદ્ધી

આત્મદર્શનાનું વિદ્ધિ-દિક્રિયોની અહિભૂખતા	૬૨
અવિવેકી અને વિવેકીનું અંતર	૬૪
આત્મરાની સર્વેષણતા ... ...	૬૬
આત્મરાનું શોષરહિતપણું ... ...	૬૭
આત્મરાની નિલખિયતા ... ...	૬૮
અબાગને સર્વમાં આત્મદર્શન	૬૯
આરથિયમાં રહેલા અજિનમાં અભિદાષ્ટ	૧૦૧
પ્રાણુમાં અભિદાષ્ટ	૧૦૨
લેદદાષ્ટની નિંદા ... ...	૧૦૩
હદ્યપુરીકુમાં રહેલ પ્રાણ	૧૦૫
લેદાપવાદ ... ...	૧૦૭
અભેદદર્શનની કર્તવ્યતા ... ...	૧૦૮

## દ્વીજી વદ્ધી

દૂન્ય પ્રકારથી અભિનું અનુસંધાન	૧૦૯
દેહસ્થ આત્મા જ જીવન છે ...	૧૧૩
મરણોત્તર કાળમાં જીવની ગતિ ...	૧૧૪
ગુલ્ય અબનો ઉપદેશ ... ...	૧૧૭
આત્માનું પ્રતિસ્પત્ત્વ ... ...	૧૧૯
આપું જ એક ખીજું દણીંત છે ...	૧૨૦
આત્માની અસંગતા ... ...	૧૨૧
આત્મદર્શી જ નિત્યસુખી છે ...	૧૨૨
સર્વ પ્રકાશનું અપ્રેકાસ્પત્ર	૧૨૬

## ગ્રીં વદ્ધો

સાંસારિક અથેત્યવૃક્ષ	...	...	...	૧૨૮
ઈશ્વરના જ્ઞાનથી અમરત્વની પ્રાપ્તિ	...	...	...	૧૩૦
સર્વશાસક પ્રભુ	...	...	...	૧૩૨
ઈશ્વરના જ્ઞાન વિના પુનર્જ્ઞામગ્રાપ્તિ	...	...	...	૧૩૨
સ્થાનભેદથી ભગવદ્દિશ્ચતમાં તારતમ્ય	...	...	...	૧૩૪
આત્મજ્ઞાનનો ગ્રંથ અને પ્રયોજન	...	...	...	૧૩૫
પરમ પદની પ્રાપ્તિ	...	...	...	૧૩૮
આત્માની ઉપલભિધનું સાધન સહખુદ્ધિ જ છે	...	...	...	૧૪૨
આમર કુચારે થાય છે ?	...	...	...	૧૪૪
ઉપસંહાર	...	...	...	૧૪૮
શાંતિપાઠ	...	...	...	૧૫૦

\*

॥ ॐ तत्सद्गुरुणे नमः ॥

# ਕੁਠੋਪਨਿਖ੍ਰਦੁ

[ ਸ਼ਾਂਕਰਭਾ਷ਧ ਸਹਿਤ ]

ਸਾਂਤਿਪਾਠ:

ॐ ਸਹ ਨਾਵਰਤੁ । ਸਹ ਨੌ ਭੁਨਕਤੁ । ਸਹ ਵੀਂਗ ਕਰਕਾਰਹੈ ।  
ਤੇਜਸ਼ਵਿ ਨਾਵਧੀਤਮਸ਼ਤੁ । ਮਾ ਵਿਦਿ਷ਾਰਹੈ ।

ॐ ਸ਼ਾਨਤਿ: ! ਸ਼ਾਨਤਿ: ! ! ਸ਼ਾਨਤਿ: ! ! !

ਅਨੁਭਾਵ : ॐ ਪ੍ਰਣਾਲੀਖਿਬ ਪਰਮਾਤਮਾ, ( ਤਮੇ ) ਨੌ=ਅਮਾਰਾ ਅੰਨੇਨੀ  
( ਗੁਰੂ-ਸਿਖਧਨੀ ), ਸਹ=ਸਾਥੇ ਸਾਥੇ, ਅਵਰਤੁ=ਰਕਾ ਕਰੋ, ਨੌ=ਅਮਾਰਾ  
ਅੰਨੇਨੁ, ਸਹ=ਸਾਥੇ ਸਾਥੇ, ਭੁਨਕਤੁ=ਪਾਲਨ ਕਰੋ; ਸਹ=( ਅਮੇ ਅੰਨੇ ) ਸਾਥੇ  
ਸਾਥੇ ॥, ਵੀਂਗਮ्=ਸਾਡਾ, ਕਰਕਾਰਹੈ=ਪ੍ਰਾਮ ਕਰੀਐ; ਨੌ=ਅਮਾਰਾ ਅੰਨੇਨੀ,  
ਅਧੀਤਮ੍=ਭਾਣ੍ਡੁਲੀ ਵਿਦਾ, ਤੇਜਸ਼ਵਿ=ਤੇਜ਼ੇਮਥੀ. ਅਲਤੁ. ਥਾਨ੍ਨੀ; ਮਾ ਵਿਦਿ਷ਾਰਹੈ=  
ਅਮੇ ਅੰਨੇ ਆਪਸਾਆਪਸਮਾਂ ਫੇਲ ਨ ਕਰੀਐ.

ਮੰਤ्रਾਰ्थ: ਹੇ ਪਰਮਾਤਮਨ! ਆਪ ਗੁਰੂਸਿਖ ਅਮਾਰਾ ਅੰਨੇ-  
ਨੀ ਸਾਥੇ ਸਾਥੇ ਸਵੰ ਪ੍ਰਕਾਰਥੀ ਰਕਾ ਕਰੋ; ਅਮਾਰਾ ਅੰਨੇਨੁ ਆਪ

સાથે સાથે ઉચ્ચિત રીતે પાલનપોષણ કરો. અમે ખજે સાથે સાથે જ સર્વ રીતે ખળ પ્રાપ્ત કરીએ; અમે ખજેએ લણેલી વિદ્યા તેજસ્વી થાએ—કોઈથી કયાંય પણ વિદ્યામાં હારીએ નહિને અમે ખજે જણ્ણા આખી જિંહગી સ્નેહથી અંધાયેલા રહ્યીએ. અમારામાં આપસ—આપસમાં કયારેય દેખન થાએ. ત્રિવિદ્ય તાપની શાંતિ થાએ.

**ભાષ્ય :** અધ્બુતવિદ્યાના આચાર્ય સૂર્યપુત્ર અગવાન યમ અને નાન્દિકેતાને નમસ્કાર.

હવે કહેબનિષદ્ધની વણીઓને સહેલાઈથી સમજવવા માટે આ સંક્ષિપ્ત આવૃત્તિનો આરંભ કરવામાં આવે છે :

વિશરણ (નાશ), ગતિ અને અવસાદન (શિથિલ કરવું) આ ત્રણ અધોવાળું તેમ જ 'ઉપ' અને 'નિ' ઉપસગ્નિયુક્ત 'કિવિ'—પ્રત્યયાંત ષદ્ગ્લ'—'સહ' ધાતુનું 'ઉપનિષદ' એવું રૂપ થાય છે. 'ઉપનિષદ' શબ્દથી ને અંથની વ્યાખ્યા અમે કરવા માગીએ છીએ તેના પ્રતિપાદ્ય અને વેદ અધ્બુતવિષયક વિદ્યાનું પ્રતિપાદન કરવામાં આવે છે. કયા અર્થના યોગને લીધે ઉપનિષદ શબ્દથી વિદ્યાનું કથન થાય છે તે ખતાવે છે.

ને મુમુક્ષુએ લૌઠિક અને પારલૌઠિક વિષયોથા વિરક્તા થઈ ઉપનિષદ શબ્દની વાચ્ય તેમ જ હવે પણ કહેવામાં આવનારાં લક્ષણોથી યુક્ત વિદ્યાની પાસે જઈને અર્થાત્ તેને પ્રાપ્ત કરીને તેની જ નિષાથી નિશ્ચયપૂર્વક તેનું પરિશીલન કરે છે, તેમની અવિદ્યા વગેરે સંસારના ભીજનું વિશરણ—હિંસન અર્થાત્ વિનાશ કરવાને લીધે આ અર્થના યોગથી જ 'ઉપનિષદ' શબ્દથી તે વિદ્યા ઉહેવાય છે. આ જ પ્રમાણે શુતિ પણ આગળ કહેશે કે, 'તેને (આત્મતત્ત્વને) જણીને પુરુષ મૃત્યુના મુખ્યથી છુટી જાય છે.'

અથવા અગાઉ કહેલાં વિશેષજ્ઞાથી યુક્ત મુમુક્ષુઓને ખલ્લવિદ્યા પરબ્રહ્મ પાસે પહોંચાડે છે. આ પ્રમાણે ખલની પાસે પહોંચાડનારી હોવાથી આ અર્થના યોગથી પણ ખલ્લવિદ્યા ‘ઉપનિષદ’ છે. આ જ વાત શ્રુતિ ‘ખલને પ્રાપ્ત થયેલો પુરુષ વિરાજ (શુદ્ધ)’. અને વિમૃત્યુ (અમર) થઈ ગયો’ આ વાક્યથી આગળ કહેશે પણ ખરી.

જે અભિ જ્ઞાન લુચઃ વગેર લોકાથી સિદ્ધ થયેલો છે, ખલાથી ઉત્પત્ત થયેલો છે અને સર્વના જાતા છે તે અભિ સાથે સંખ્યાધ રાખનારી વિદ્યા કે જે ખીજ વરદાન તરીકે નચિકેતાએ યમ પાસે માળી છે ને જે વિદ્યા કે સ્વર્ગલોકરૂપ ઇલગ્રામિના કારણુરૂપથી આન્ય લોકોમાં વારંવાર પ્રાપ્ત થનારા ગુર્ભવાસ, જગત અને વૃદ્ધિવસ્થા વગેરે ઉપર્દ્વ સમૂહોનું અવસાદન કરનારી છે અર્થાત् તેમને શિથિલ કરી નાખનારી છે એટલે કે પ્રસ્તુત ઉપર્દ્વાનો અંત આણુનારી છે; તેથી તે અભિ વિદ્યા પણ ‘સદ્ગુરુના અર્થના યોગથી ‘ઉપનિષદ’ કહેવાય છે. ‘સ્વર્ગલોકને પ્રાપ્ત કરનારા પુરુષો અમરત્વ પામે છે અર્થાત્ ભરણુને અધીન થતા નથી’ એવું હવે પછી કહેવામાં આવશે (કૃ. ઉ. ૧-૧-૧૩ વગેરેથી કહેશે).

વળી અધ્યયન કરનારાઓ તો ‘ઉપનિષદ’ શાખાથી અંથનો પણ ઉદ્દેશ્ય છરે છે, જેમ કે, ‘અમે ઉપનિષદ ભાગીએ છીએ અથવા તો ભાગુાપીએ છીએ’ વગેરે; તેથી શું સમજાવું?

શાંકા ઉચ્ચિત છે; જાણેને એમ કહેવામાં આવે. એમ કહેવું પણ દોપચુક્ત નથી. સંસારના હેતુભૂત અવિદ્યા વગેરેના વિશરણ વગેરે જે ‘સહ્દ’ ધાતુના અર્થ છે તે કેવળ અંથમાં સંભવિત નથી; પરંતુ વિદ્યાના અર્થમાં સંભવી શકે છે. અંથ પણ વિદ્યાને માટે જ છે. તેથી ‘ઉપનિષદ’ શાખાથી એ પ્રમાણે ભાગીએ છીએ અથવા તો ભાગુાપીએ છીએ પણ કહી શકાય; જેમ કે (આયુર્વેણી વૃદ્ધિ થવામાં ઉપયોગી હોવાને લાધે) ધી, એ આયુર્વે જ છે’ (આયુર્વે ઘૂતમ્)

એમ કહેવામાં આવે છે. એટલા માટે ‘ઉપનિષદ’ શબ્દ વિવામાં મુખ્ય વૃત્તિથી યોજન્ય છે અને અથવા અથ્રોમાં ગૌણુવૃત્તિથી પ્રયુક્ત થાય છે.

આ પ્રમાણે ‘ઉપનિષદ’ શબ્દનું નિર્વચન અર્થાત નિરૂપિત કરવાથી જ વિદ્યાનો વિશિષ્ટ અધિકારી ઓળણ છે તે કહેવામાં આવ્યું, તેમ જ વિદ્યાનું પ્રત્યગાત્મકસ્વરૂપ પરખણીનું વિશિષ્ટ વિષય પણ કહી હેવામાં આવ્યો. એ જ પ્રમાણે આ ઉપનિષદની સંસારની આત્માંતિક નિવૃત્તિ અને અધ્યપ્રામિકનું પ્રયોજન તથા એ પ્રકારના પ્રયોજનથી અને ( સાધ્ય-સાધનરૂપ ) સંબંધ પણ બતાવી દીધો. માટે ઉપર કહેલી અધિકારી, વિષય, પ્રયોજન અને સંબંધવાળી વિદ્યાને હાથમાં રહેવા આંબળાની પેઠે પ્રકાશિત કરનારી હોવાથી આ કોપનિષદની વસ્તુઓ વિશિષ્ટ અધિકારી, વિષય, પ્રયોજન અને સંબંધવાળા છે તેથી અમે અમારી ખુલ્લી પ્રમાણે તેમની વ્યાપ્તયા કરીશો છીશો,

# પહેલો અદ્યાત્ર

પહેલી વદ્વી

વાજશ્રવસનું દાન

ॐ ઉશન્દ વૈ વાજશ્રવસઃ સર્વવેદસં દદૌ । તસ્� હ નચિકેતા  
નામ પુત્ર આસ ॥ ૧ ॥

**અનુબય :** ઓ=ઓ આ સચિયદાનંદ્ઘન પરમાત્માના નામનું  
સ્મરણું કરીને ઉપનિષદનો આરંભ કરે છે, હ વૈ=ખણ્ણિતું છે કે,  
ઉશન्=યશનું ઇળ ઈચ્છનારા, વાજશ્રવસઃ=વાજશ્રવાના પુત્ર ( ઉદ્ધાલકે ),  
સર્વવેદસમુ=( વિશ્વજિત યશમાં ) પોતાનું બધું ધન, દદૌ=( ખાદ્યણોને )  
આપી હીધું. તસ્ય=તેનો, નચિકેતા=નચિંદેતા, નામ હ=નામથી પ્રસિદ્ધ:  
પુત્ર: આસ=( એક ) પુત્ર હતો. ૧

**મંત્રાર્થ :** આ વાત જાણીતી છે કે યશકુળની ઈચ્છા  
રાખનારા વાજશ્રવાના પુત્ર ઉદ્ધાલકે ( વિશ્વજિત યશમાં )  
પોતાનું બધું ધન ( ખાદ્યણોને ) આપી હીધું. તેને નચિકેતા  
નામનો એક પ્રસિદ્ધ પુત્ર હતો. ૧

**ભાષ્ય :** આહો આ ને આપ્યાયિકા છે તે વિદ્યાની સ્તુતિ માટે  
છે ઉશન્દ એટલે કામનાવાયો. ‘હ’ અને ‘વૈ’ આ બે નિપાત  
અવ્યયો અગાઉ બની ગયેલા પ્રસંગનું સ્મરણું કરાવવા માટે વપરાયા  
છે. ‘વાજ’ એટલે અજ; તેનું દાન કરવાથી નેનો ‘શ્રવ’ અર્થातુ  
યશ ઝેલાયો હોય તે ‘વાજશ્રવા’ કહેવાય છે અથવા રહિથી પણ  
તેનું આ નામ હોઈ શકે છે. તે વાજશ્રવાના પુત્ર વાજશ્રવસે, જેમાં  
સર્વસૂવ આપી હેવામાં આવે છે એવા ‘વિશ્વજિત’ યશ વડે તેનું  
કુળ મેળવવાની ઈચ્છાથી યશનું યજન કર્યું. તે યશમાં તેણે સર્વવેદસુ

અર્થાત् પેતાનું બહું ધન આપી દીધું. એવું કહેવાય છે કે તે વજભાનને  
નચિકેતા નામનો એક પુત્ર હતો. ૧

તંહ કુમારસ્તં દક્ષિણાસુ નીયમાનાસુ શ્રદ્ધાવિવેશ  
સોમન્યત ॥ ૨ ॥

દક્ષિણાસુ નીયમાનાસુ=( ને વખતે આદ્ધારાને ) દક્ષિણાના ઇપમાં  
આપવા માટે ( ગાયો ) લાવવામાં આવી રહી હતી તે સમયે;  
કુમારમૂ=નામો બાળક, સત્તમૂ=હોવા છતાંય, તમ હ=તે( નચિકેતા )માં,  
શ્રદ્ધા=શ્રદ્ધા ( આસ્તિકુય ખુદ્ધિ )નો, આવિવેશ=પ્રવેશ થયો ( અને ). સઃ=  
( તે ઘરડી ગાયોને જોઈને ) તે, અમન્યત=વિચારવા લાગ્યો. ૨

ને વખતે દક્ષિણાયો ( દક્ષિણાસ્તવરૂપ ગાયો ) લાવવા-  
માં આવી રહી હતી જ્યારે, તેનામાં-જોકે હજુ તે એક  
નામો બાળક જ હતો—શ્રદ્ધા ( આસ્તિકુય ખુદ્ધિ )નો પ્રવેશ  
થયો. તે વિચારવા લાગ્યો. ૨

માણ્ય : ને કુમાર છે અર્થાત् પ્રથમાવસ્થા એટલે બાલ્યાવસ્થામાં  
જ સ્થિત છે ન જેને ચંતાનના ઉત્પાદનની શક્તિ પ્રાપ્ત થઈ નથી  
તે બાળક નચિકેતામાં શ્રદ્ધાનો એટલે પિતાનું ભલું કરવાની પણાથી  
આસ્તિકુય ખુદ્ધિનો પ્રવેશ થયો. ક્યે વખતે તેનામાં આ ખુદ્ધિ નીપળું ?  
એ વિષે કહે છે કે જ્યારે જરૂરિયાને અને સદસ્યોને આપવા માટે  
દક્ષિણા આપવામાં આવી રહી હતી; અર્થાત્ દક્ષિણા આપવા માટે  
ભાગ પાડીને ગાયો લાવવામાં આવી રહી હતી તે વખતે નચિકેતાએ  
શ્રદ્ધાયુક્ત થઈને વિચાર કર્યો. ૨

કઈ રીતે વિચાર કર્યો તે કહે છે :

નચિકેતાની શંકા

પીતોદકા જગ્ઘતૃપા દુઃખદોહા નિરિન્દ્રિયાઃ ।

અનન્દા નામ તે લોકાસ્તાન્સ ગજીતિ તા દદત ॥ ૩ ॥

પીતોદકાઃ=નેચો ( છેલ્લી વાર ) પાણી પી ચૂકી છે, જગ્ઘતૃણાઃ=નેચો ( છેલ્લી વાર ) ધાસ ખાઈ ચૂકી છે. દુંઘદોહાઃ=નેમનું દૂધ ( છેલ્લી વાર ) દોહવાઈ ચૂક્યું છે, નિરિન્દ્રિયાઃ=નેમની ઈદ્રિયાની શક્તિ હણ્ણાઈ ચૂકી છે, તાઃ=એવી તે ( નકામી, મરવા પડેલી ) ગાયોને, દદત=આપનારો, સઃ=તે દાતા ( તો ), તે લોકાઃ=તે ( ભૂંડ અને ઝૂતરા વગેરેની નીચ થોનિયો અને નરક વગેરે ) લોક, અનન્દાઃ=ને સર્વ પ્રકારનાં સુખોથી રહિત, નામ=પ્રસિદ્ધ છે, તાન્=તેમને, ગંગતિ=પામે છે ( માટે પિતાને સાવધ કરવા જોઈએ. ) ૩

જે ગાયો છેલ્લીવાર પાણી પી ચૂકી છે ( ને હુવે વધુ પાણી પી શકે તેવી હાલતમાં નથી ); નેમણે છેલ્લી વારનું ધાસ પણ ખાઈ લીધું છે ( ને ધરડી થઈ ગયેલી હોવાથી હાંત અને હાઢો પડી ગયાં છે તેથી ચાવવાની શક્તિ નાથ થઈ ગયેલી છે એથી ધાસ ખાઈ શકે તેમ નથી ); અને ( ધડપણુને લીધે ) ઈદ્રિયાની શક્તિ હણ્ણાઈ જવાથી અજનનકાયાનો અલાવં થઈ ગાયો છે એવી ગાયોનું દાન કરવાથી તેમને હાતા અનંદ ( આનંદરહિત ) લોકને પામે છે ને ભૂંડ તેમ જ ઝૂતરાં વગેરેની થોનિયોમાં જન્મે છે તથા નરકગામી થાય છે; તેથી મારે ( નચિકેતાએ ) મારા પિતા વાજશ્રવસ-ઉદાલક આદું નિંદનીય કામ કરતા આટકે તે માટે તેમને ચેતાવવા જોઈએ. ૩

માણ્ય : દક્ષિણા માટે લાવવામાં આવેલી ગાયોનું વિરોધપણ હશાવિ છે : નેમણે પાણી પી લીધું છે તે ‘પીતોદકા’ કહેવાય; નેચો ધાસ ખાઈ ચૂકી છે ( અર્થાત નેમનામાં ખીજું વધુ ધાસ ખાવાની શક્તિ રહી નથી ) તે ‘જગ્ઘતૃણા’ છે; નેમનું દૂધ અર્થાત ક્ષીર દોહવાઈ ચૂક્યું છે તે ‘દુંઘક્ષીણા’ છે તથા ‘નિરિન્દ્રિયાઃ’ એટલે

જે સંતાન ઉત્પત્ત કરવામાં અસમર્થ અર્થાત् ઘરડી થઈ ગઈ છે ને  
વસ્તુ ગઈ છે એવી ગાયોની દક્ષિણામાં આપવાની બુદ્ધિથી આપનારો  
યજ્ઞમાન અનાંદ અર્થાત् સુખ અને આનંદથી રહિત લોકોમાં જાય છે.

### પિતા-પુત્ર સંવાદ

સ હોવાચ પિતરં તત કસ્મै માં દાસ્યસીતિ ।

દ્વિતીયं તૃતીયं તઽહોવાચ મૃત્યવે ત્વા દદામીતિ ॥ ૪ ॥

સ: હ=તે આવો વિચાર કરીને, પિતરમ્=પોતાના પિતા પ્રતિ,  
ઉવાચ=ખોલ્યો કે, તત્ (તાત)=હે વહ્નાલા પિતાજી ! તમે, મામ્=મને,  
કસ્મै=ક્રાને, દાસ્યસિ ઇતિ=આપશો ? (ઉત્તર ન મળવાથી તેણે તે જ  
વાત) દ્વિતીયમ્=ખીજુ વાર, તૃતીયમ્=નીજુ વાર (કહી), તમ્ હ=(એટલે  
પિતાએ) તેને, ઉવાચ=(કોધપૂર્વક આ પ્રમાણે) કહું, ત્વા=તને  
(હું) મૃત્યવે=મૃત્યુને (યમરાજને) દદામિ ઇતિ=આપું છું. ૪

તે હવે પોતાના પિતા પ્રતિ એવોઃ ‘હે તાત ! મને  
તમે કેને આપશો ?’ આ પ્રમાણે તેણે બેગણ વાર પૂછ્યું  
તેથી પિતાએ તેને કહું, ‘હું તને મૃત્યુને આપીશ.’ ૪

ભાગ્ય : આ પ્રમાણે કરવાથી યજ્ઞ પૂર્ણ નહિ થાય તેથી પિતાને  
પ્રાપ્ત થતારું અનિષ્ટ ઇણ હું પુત્ર વિદ્યમાન છું તો મારે આત્મ-  
ભલિદ્ધાન-આપીને પણ તે અનિષ્ટ ઇણ નિવારણ જોઈએ. એમ  
માનીને તે પિતાની પાસે જરૂરી કહેવા લાગ્યો, ‘હે તાત ! આપ  
મને કંયા ખાસ કંતિવજ્ઞને દક્ષિણામાં આપશો ?’ આમ કણ્ઠાથી  
પિતાએ વારંવાર જીવેશ્વરા છતાં પણ તેણે ખીજુ ને નીજુ વાર પણ  
‘મને છુને આપશો ? મને ડાને આપશો ?’ આમ કહું; એટલે  
પિતાએ વિચાર કર્યો કે, આ ખાળોના જોવા સ્વભાવવાળો નથી  
તેથી જિજ્ઞાસને તેણે પુત્રને કહું, ‘તને હું વૈવસ્વતને અર્થાત્ સ્ફુર્ણના  
પુત્ર યમરાજને એટલે કે મૃત્યુને આપું છું.’ ૪

પિતાએ આ પ્રમાણે કહેવાથી તે પુત્ર એકાંતમાં અતુતાપ કરવા લાગેલો કઈ રીતે, તે કહે છે :

**बहूनामेमि प्रथमो बहूनामेमि मध्यमः ।**

**किञ्चित्स्विद्यमस्य कर्तव्यं यन्मयाद्य करिष्यति ॥៥॥**

बहूनाम्=હું ધણું શિષ્યોમાં તો, પ્રથમः=પણેલી પંક્તિના આચરણું પર, એમિ=ચાલતો આચર્યો છું ( અને ) બહूનામ्=ધણુંએમાં, મધ્યમः= મધ્યમ એણીના આચરણું પર, એમિ=ચાલું છું ( ક્યારેય હલક્કી આદિનું આચરણ મેં કચું નથી, તો પણી પિતાજીએ એમ શાથી કહ્યું ? ) યમસ્ય=યમદું, કિસ્ત સ્વિત્ર કર્તવ્યમ्=એવું કચું કામ હોઈ શકે છે, યત્ અદ્ય=એ આજે, મયા=મારા વડે ( મને આપીને ), કરિષ્યતિ=( પિતાજી ) પૂણું કરશે.

હું ધણું( શિષ્યો કે પુત્રો )માં તો પ્રથમ ( સુધ્ય-વૃત્તિથી ) ચાલું છું ને ધણુંએમાં મધ્યમ ( મધ્યમ વૃત્તિથી ) જાઉં છું. યમનું એવું તો કચું કાય છે જે પિતા આજે મારી મારક્ષતા સિદ્ધ કરશે ? ૫

ભાષ્ય : હું ધણું શિષ્ય આથવા પુત્રોમાં તો પ્રથમ અર્થાત् આગળ રહીને મુખ્ય શિષ્ય વગેરેની વૃત્તિથી ચાલું છું તથા ખીજ ધણું મધ્યમ શિષ્યો વગેરેમાં મધ્યમ રહીને મધ્યમ વૃત્તિથી વતું છું હલક્કી વૃત્તિથી હું ક્યારેય રહેતો નથી. એવા વિશિષ્ટ ગુણોથી યુક્ત પુધરને પણ પિતાએ ‘ હું તને મૃત્યુને આપું છું ’ એમ કહ્યું ; પરંતુ યમનું એવું તે કચું કર્તવ્ય-પ્રયોજન છે કે જે એમને પૂણું કરવાનું છે, જેને તેઓ આ પ્રમાણે અપાયેલા મારા વડે સિદ્ધ કરશે ? ખરેખર ડ્રાઈ પણ પ્રયોજનની અપેક્ષા રાખ્યા વિના જે પિતાજીએ કોધના આવેશમાં આમ કહ્યું છે ; તોપણું ‘ પિતાજીનું ’ વચ્ચે મૃદ્યાન્ત થાય એવા વિચાર કરીને, ‘ મેં શું કહી નાખ્યું ? ’ એવા વિચારથી

શોકાતુર થઈ રહેલા પોતાના પિતાને, ખેડૂપૂર્વક છેલેવા લાગ્યો. ૫

અનુપરથી યથા પૂર્વે પ્રતિપરથી તથાડ્યરે ।

સસ્યમિબ મર્યાદ: પચ્યતે સસ્યમિબાજાયતે પુનઃ ॥ ૬ ॥

પૂર્વે=આપના પિતામણ વગેરે પૂર્વનો, યથા=ને પ્રકારનું આચરણ કરતા આવ્યા છે, અનુપરથી=તેના પર વિચાર કરે ( અને ), અપરે= ( વર્ત્તમાનમાં પણ ) બીજા શ્રેષ્ઠ લોકો, ( યથા=નેથું આચરણ કરી રહ્યા છે; ) તથા પ્રતિપરથી=તે ઉપર પણ નજીર નાખી જુઓ ( ત્યાર પછી આપ આપના કર્તાબ્યનો નિશ્ચય કરનો ); મર્યાદ:=( આ ) મરણધર્મ મનુષ્ય, સસ્યમ् ઇવ=આનાજની પેડે, પચ્યતે=રંધાય છે અર્થાત્ જરાળણું થઈને એટસે ઘડપણુથી ઘસાઈ-પિસાઈને મરી જય છે, ( તેમ જે ) સસ્યમ् ઇવ=આનાજની પેડે જે, પુનઃ=કરીથી, આજાયતે= જગી નીકળે છે અર્થાત્ ઉત્પત્ત થાય છે. ૬

હે પિતાજી ! આપણું પૂર્વનેનું આચરણ જુઓ। ને આ સમયના બીજા શ્રેષ્ઠ પુરુષોનું આચરણ જુઓ। તેમના આચરણમાં પહેલાં ક્યારેય અસત્ય ન હતું. ને અત્યારે પણ નથી. ખરાખ માણુસે જ અસત્યનું આચરણ કરતા હોય છે, પણ એ અસત્યને આચરણાથી કોઈ અજરઅમર થઈ શકતું નથી. માણુસ મરણધર્મ છે. એ આનાજની પેડે રંધાઈને અર્થાત્ ઘડપણુથી ઘસાઈ-પિસાઈને મરે છે ને આનાજની પેડે જ કરીથી પ્રારંધકર્મને લીધે જે-મે છે. ૬

ગ્રાણ : આપણા પિતા-પિતામણ વગેરે પૂર્વનો અનુકૂમે ને પ્રમાણે આચરણ કરતા આવ્યા છે તેમના તરફ જુઓ; એમને જોઈન તમારે એમના જ આચરણનું પાલન કરવું જોઈએ. એ જ પ્રમાણે વર્ત્તમાન યુગના બીજા ને સાધુ પુરુષો આચરણ કરે છે તેમના ખાળું નજીર નાખી જુઓ. તેમનામાંના કોઈનું પણ આચરણ

ભરાય માણુસો અર્થાત અસાધુ પુરુષોનું આચરણ  
ગિયા કરીને એઈ પણ માણુસ અજર ને અમર  
કારણ કે માણુસ મરણધર્મા છે તેથા તે અનાજની  
લાંબું થયા પછી મરી જાય છે; ને મરણ પછી  
તેની પેડે ઇરીથી પેદા થાય છે. આ અમાણુ આ  
એ અસત્ય આચરણથી લાલા કૃયો લાલ છે?  
આચરણથી કશો જ લાલ નથી એટલા માટે તમે  
પાલન કરો ( અર્થાત જોત્યા છો એ અમાણુ વતો )  
પાસે મેઠલી હો ! ૬

**યમલો! કુમાં નચિકેતા॥**

**વિશત્યતિથિપ્રાહ્મણો ગૃહાન् ।**

**નન્તિ કુર્વન્તિ હર વૈવસ્વતોદકમ् ॥ ૭ ॥**

સૂર્યપુત્ર ( યમરાજ ), વैશ્વાનર=( પોતે ) અભિ ( જ ),  
આંદું અતિથિના ઇપમાં, ગૃહાન્=( ગૃહસ્ಥનાં )  
નધારે છે; તસ્ય=તેની, ( સારા માણુસો ) એતામ્=  
ની એટલે કે અધ્ય=પાદ=આસન વગેરેથી ) શાન્તિમ્=  
રતા હોય છે; ( એટલા માટે તમે ) ઉદ્કમ્ હર=  
માટે ) જલ લઈ આવો. ૭

અતિથિ થઈને અશ્વિર્પે જ ધરમાં પ્રવેશ  
પુરુષો ) તે અતિથિની આ અમાણુ ( અધ્ય,  
રેથી ) શાંતિ કરતા હોય છે; એટલા માટે  
આ પ્રાણીણુ અતિથિની શાંતિ માટે ) જલ  
વો. ૭

ભાષ્ય : પુત્રે આ ગ્રમાણે કહેવાથી પિતાએ પોતાનાં વિચનોની સત્યતા પુરવાર કરવા માટે બાળક નચિકેતાને યમરાજની પાસે મોફલી આપ્યો. તે યમરાજના ધામમાં પહોંચ્યો ત્રણ રાત સુધી ત્યાં રહ્યો; કારણ કે એવામાં યમરાજ કૃત્યાંક બહાર ગયેલા હતા. અવાસેથી પાછા કૃત્યાંક ધામરાજનાં પતની તેમજ તેમના પ્રધાનોએ તેમને વિનિતિપૂર્વક સમજીવતાં કહ્યું કે, ખાલીણ અતિથિ થઈને પ્રત્યક્ષ વૈશ્વાનર અર્થાત् અમ્રિના ઇપમાં દાડિતો હોય તેમ ધરમાં પ્રવેશે છે. તે અમ્રિના દાડિને શમાવવા માટે જ જાણે ન હોય તેમ, સાંધુ પુરષો—ગૃહસ્થજન આ અર્થ—પાદ વગેરે દાનરૂપ શાંતિકમ્બ કરતા હોય છે. એટલા માટે હે વૈવસ્વત ! નચિકેતાને અધ્યું આપવા માટે તેમજ પાદપ્રક્ષાલન માટે જલ લઈ આવો; કારણ કે એમ ન કરવામાં આવે તો હાનિ થાય છે, એમ સાંલઘ્યું છે. ૭

આશાપ્રતીક્ષે સજ્જતઃસ્તુતાં ચ ઇષ્ટાપૂર્તે પુત્રપરૂઃ શ્ર સર્વાન् ।  
એતद્વૃદ્ધક્તે પુરુષસ્યાલ્યમેધસો યસ્યાનશ્રન્વસતિ બ્રાહ્મણો ગૃહે ॥૮

યસ્ય=જેના, ગૃહે=ધરમાં, બ્રાહ્મણઃ=ખાલીણ અતિથિ, અનશ્રન્=ખાધા વિના, વસતિ=રહે છે; (તસ્ય=તેનાં) અલ્યમેધસઃ=એઠી ખુદ્ધિનાં, પુરુષા=માણુસનાં, આશાપ્રતીક્ષે=નાના પ્રકારની આશા અને પ્રતીક્ષા, સજ્જતમુ=તે પૂરા પડવાથી થનારી સર્વ પ્રકારનાં સુખ, સ્તુતામું ચ=સારી વાણીનાં કૃણ તેમજ, ઇષ્ટાપૂર્તે ચ=પરા, દાન વગેરે શુલ કર્માનાં તેમજ કુવો, ખાગ-ખગીચાને તળાવ વગેરે ખનાવડા-વ્યાનાં કૃણ, તથા સર્વાનું પુત્રપરૂસ=સધળાં પુત્ર અને પશુઓને, એતદ્વૃદ્ધક્તે=આ અધાનો (તે) નાશ કરી નાખે છે. ૮

જેના ધરમાં ખાલીણ-અતિથિ લોજન કૃત્યો વિના રહે છે, તે મંદ્યખુદ્ધ માણુસની આશા અને પ્રતીક્ષા અર્થાતું પોતાને મળવા જોઈ એવા જાત પદાશ્રીની ધરણાએ,

તેમના સંયોગથી પ્રાત થનારાં કુળ, પ્રિય વાણીથી મળનારાં કુળ તેમ જ યાગાદિ ઈષ્ટ કર્મો અને કુવો, યાગ—બગીચા, ધર્મશાળા બંધાવવી વગેરે પૂર્ત કર્મોનાં કુળ તથા સર્વ પુત્ર ને પશુ વગેરેનો નાશ કરી નાણે છે. ૮

**ભાષ્ય :** જેના ધરમાં આલણ બોજન કર્યા વિના રહે છે તે મંદ્રમતિ માણુસનાં ‘આશા—પ્રતીક્ષા’—આશા એટલે જેના મળવાની કંઈ ખબર નથી એવા મેળવવા માટેના ઉષ પદાર્થોની ઉચ્છા અને પ્રતીક્ષા એટલે પોતાને મળવા જોઈ એ એવા શાત પદાર્થોની પ્રતીક્ષા અને સંગત એટલે તેમના સંયોગથી પ્રાત થનારાં કુળ, સુજૃતા એટલે મધુર અને પ્રિયવાણીથી મળનારાં કુળ. ‘ઉષપૂર્ત’ અર્થાત્ ઉષ એટલે યજ્ઞયાગાદિથી પ્રાત થનારાં કુળ અને પૂર્ત એટલે કુવો જોડાવવો, યાગબગીચા તેમ જ ધર્મશાળા વગેરે બનાવડાવવાથી થનારાં કુળ તથા પુત્ર અને પશુ વગેરે આ બધાનો તે નાશ કરે છે. એટલા માટે અતિથિ પ્રત્યે કુદ્યારેય ઐદ્રકારી સેવવી નહીં તેમ જ તેની ઉપેક્ષા પણ કરવી નહીં ( અર્થાત્ અતિથિ-અજ્ઞયાગતનો સર્વ રીતે સારી પેઠે આદરસટકાર કરીને તને જમાડી પ્રસન કરી તેમની સહલાવના મેળવવી ). ૯

### યમરાજનું વરપ્રદાન

તિસ્સો રાત્રીર્યદવાત્સીર્ઘૃહે મે અનશ્નબ્રહ્મતિથિર્નમસ્યઃ ।  
નમસ્તેઽસ્તु બ્રહ્મસ્વસ્તિ મેઽસ્તુ તસ્માન્તિ ત્રીન્વરાન્વૃણીષ્વ ॥૯॥

ब्रह्मन्=હે आलणु हेवता, नमस्यः अतिथिः=आप नमस्कार करવा योग अतिथि છો. ते=તમને, नમः अस्तु=नમस्कार હે; ब्रह्मन्=હે आलणु ! મે स्वस्ति अस्तु=મારુं કલ્યાણ થાઓ; યत्=જો ( તમે ) તિસ્સઃ રાત્રીઃ=ત્રણ રાત સુધી, મે=મારા, ગૃહે=ઘરે, અનશ્ન=બોજન કર્યા વિના, અવાત્સીઃ=રહ્યા છો, તસ્માત्=તેથી ( તમે મારી માસે ) પ્રતિ=દરેક

रात्रिना भद्रतामां ( एक एक करी ), त्रीन् वरान्-त्रिण् वरदान्, वृणीष्व=मार्गी लो. ६

हे अहम् ! तमने नमस्कार हो; मारुं कृत्याणु थाओ। तमे नमस्कार योऽय अतिथि होहु ने पशु मारा धरमां त्रिण् रात सुधी जन्म्या विनाना रह्या तेथी हरेके रात्रिना भद्रतामां एक एक करी त्रिण् वरदान मारी पासेथी मार्गी लो. ६

**भाष्य :** ( भावांशोऽमे ) आ प्रमाणे कृत्याथा यमराज नविकेतानी पासे गया ने तेनु पूजन कर्त्ता पक्षी तेमाणे तेने कहुः ‘ हे अहम् देवता ! तमे अतिथि छो अने नमस्कार योऽय छो, छतांय तमे त्रिण् रात सुधी कृच्छ खण्डु खाधा विना मारा घेर रह्या छो तेथी तमने नमस्कार छे. अने हे अहम् ! अथा थेला होपने लीघे भने प्राप्त थेल अविष्ट कृपानी शांति थईने मारुं कृत्याणु थाओ। ज्ञेके तमारी कृपाथी ज सर्वं रीते मारुं कृत्याणु थरो; तोपशु तमे मारा पर वधारे प्रसन्न थाओ औटला माटे तेम ज तमेको भाजन कर्त्ता विना गालेली हरेके रात्रिना भद्रतामां मारी पासेथी त्रिण् वर-तमेने गमे ते त्रिण् कामनाओ पूरी थवा माटे-मार्गी लो. ६

### अथ व२-पितृपूरितेऽपि

**शान्तसङ्कल्पः** सुमना यथा स्याद्वीतमन्युगौतमो मामि मृत्यो । त्वत्प्रसृष्टं मामिवदेत्प्रतीत एतत्त्वयाणां प्रथमं वरं वृणो ॥ १० ॥

मृत्यो=हे मृत्युहेतु । यथा=जे रीते, गौतमः=गौतमवंशमां उपनिषद् थेला ( मारा पिता ) उदाधुक, मा अमि=मारा प्रति, शान्तसङ्कल्पः=शांत सङ्कल्पवाणी, सुमना:=प्रसन्नचित्त, ( अने ) वीतमन्युः=छोध तेम ज ऐहरहित, स्यात्=थाय, ( ने ) त्वत्प्रसृष्टम्=तमे मोठलेलो हु तेमनी पासे न्हाउ त्यारे, मा प्रतीतः=तेअ। मारा ५२ विश्वास करी ( आ ते ज

मारो पुत्र नयिता छे, एवो लाप राखी ), अभिवदेत्=मारी साथे वात्सल्यपूर्वक वातचीत करे; एतत्=आ, ( हुं ) त्रयाणाम्=मारां त्रण वरदानमांथी, प्रथम् बरम्=पहेलुं वरदान, बृणे=भागुं हुं. १०

हे मृत्युहेव ! जे रीते मारा पिता वाजश्रवस् उदालक मारा प्रत्ये शांत संकल्पवाणा, प्रसन्नचित्त तेमज्ज छोध ने ऐहरहित थाय ने आप क्यारे मने मारे घेर पाछो मोळेलो त्यारे मने तेचो। एताप्पे ने मारा पर विश्वास राखी वहालथी मारी साथे वातचीत करे ( तेवुं आपे आपवा धारेलां ) त्रण वरदानेमांथी आ पहेलुं वरदान हुं भागुं हुं.

भाष्यः नयिताच्ये कल्युः : जो आप वरदान आपवा धर्मात् हे तो मारा पिता गोतम मारा प्रति के रीते शांतसंकल्प अर्थात् जेमनो ‘शी अणुर भारी पुत्र यमराज पासे ७६७ शु ५२रो ।’—एवो संकल्प शांत थर्ह गयो छे तेवा, सुमनाः गोट्ये प्रसन्न चित्तवाणा ने छोधरहित थर्ह ज्ञयो; अने हे मृत्यै। आप मने घेर पाछो मोळेलो लारे मारा पर विश्वास राखीने तथा ‘आ मारो तेज्ज पुत्र मारी पासे पाछो इयों छु’ आगुं जाणीने मारी साथे वातचीत करे तेवुं तथा त्रण वरदानेमांथी आ मारा पितानी प्रसन्नतात् ने तेमनो परितोष थाय एवा अयोज्जनवाणुं पहेलुं वरदान हुं भागुं हुं. १०

यथा पुरस्ताऽविता प्रतीत औदालकिरारुणिर्मत्सुष्टः ।

सुखङ्गरात्रीः शयिता वीतमन्युस्त्वां ददशिवान्मृत्युमुखात्यमुक्तम् ॥

त्वाम्=तमने, मृत्युमुखात्=मृत्युना मुखमांथी, प्रमुक्तम्=शृता थयेला, ददशिवान्=जोईने, मत्प्रसृष्टः=भाराथी गेराईने, आरुणिः=( तमारा पिता ) आरुणु—पुत्र, औदालकिः=उदालक, यथा पुरस्तात्=पहेलांनी पेठे ज्ज, प्रतीतः=आ मारो पुत्र नयिता ज्ज छे एवो विश्वास करीने, वीतमन्युः=दुःख अने कोधथी रहित, भविता=थर्ह ज्जरो; रात्रीः—( अने तेचो पोताना जुवनमांनी बाकीनी ) रात्रिअमां, सुखम्=सुखपूर्वक, शयिता=जीधरो. ११

तमने मृत्युना मुण्डमांथी पाछा क्रेत्वा ज्ञेय ने मारी  
प्रेरणाथी तमारा पिता अरुणुपुत्र उदालक धणा खुश थरो.  
तमने पोताना पुत्रइपे ओगणीने तमने पहेलांनी पेठे ७  
वडाल करशे ने तेमनां कोऽध अने हुःण शांत थई जरो.  
तमने पाछा मेणपीने तेओ ज्ञवनलार सुणथी उघरशे. ११

**भाष्य :** मृत्युओ कहुँ : तमारा पितानी खुळि ने अमाणे  
तमारा ग्रन्थे वडाललरी हुती ते ७ अमाणे ते औदालकि हजु पण  
वडाललया थई तमारा प्रति विश्वास धरावता थरो. अहीं उदालकने ७  
'औदालकि' कह्या. छ तेम ७ अरुण्युना पुत्र लेवाथी ते आरुणि  
छ; अथवा तो ते द्यामुण्यामणु<sup>x</sup> लेवानुं पण संलवी शडे. मत्प्रस्तुषः  
अटले माराथा आज्ञा पाभी अर्थात् प्रेराईने ते ( ज्ञवननी ) णाडीनी  
राविओमां सुणपूर्वक अटले प्रसन्नचित्तथा उघरशे ते तमने मृत्युना  
मुण्डमांथा अर्थात् मृत्युना अधिकारथी मुक्ता थेला ज्ञेय ने वीतमन्तु  
अटले कोधरहित थई जरो. ११

### स्वर्गस्वरूप प्रदर्शन

स्वर्गे लोके न भयं किञ्चनास्ति न तत्र त्वं न जरया बिभेति ।  
उमे तीत्वर्गिनायापिपासे शोकातिगो मोदते स्वर्गलोके ॥ १२ ॥

स्वर्गे लोके=स्वर्गसेइमांभां, किञ्चन भयम्=ज्ञरा॒॒॒॒ ज्ञेयलोके भय,

<sup>x</sup> ऐ पिताओता संकेतथा ने अड पुत्रने पोतानो उत्तरा-  
धिकार अर्थात् वारसदार नीमवामां आवे छे, ते पुत्र द्यामुण्यामणु  
कहेवान छे ते अटले ७ अने पिताओनी भिलकडतानो धणी ने तेमने  
पिडहान ४२वानो अधिकारी थाय छे ज्ञेयी रीते पुत्रइपे स्वीकारेलो  
दीकराने। हीडरो अथवा जेणी लीचिदो बीज्ञे दसकपुत्र वगोरे हेय  
छे ते पुत्र. अटला माटे अडला वाज्ञावसने ७ औदालक अने  
आरुणि उहेवामां आवे छे; तेथी अनवाज्ञे छे ते उदालक अने  
अरुणु अने पिताओता अधिकारी अर्थात् वारसदार हेय.

ન અસ્તિ=નથી, તત્ત્વ લ્બમ् ન=ત્યાં ભૂતયુરૂપ આપ મેતે પણ નથી; જરયા ન વિમેતિ=ત્યાં કોઈ ધડપણુથી પણ બીજું નથી; સ્વર્ગલોકે=સ્વર્ગ-લોકમાં રહેનારા, અરાનાયાપિપાસે=ભૂખ અને તરસ, ઉમે તીત્વા=આ બનથી તરી જઈને; શોકાતિગઃ=હૃદાયાથી દૂર રહી, મોદતે=આનંદ લોગવે છે. ૧૨

હે ભૂત્યુદેવ ! સ્વર્ગલોકમાં કશો પણ જીવ નથી; ત્યાં આપનું પણ કંઈ ચાલતું નથી; ત્યાં કોઈ ધડપણુથી બીજું નથી. સ્વર્ગલોકમાં બસનારો પુરુષ ભૂખ-તરસ બનેને તરી જઈ શોકને એળાંગી જઈ ને આનંદ લોગવે છે. ૧૨

**ભાષ્ય :** નચિકેતા ઓદ્યો : સ્વર્ગલોકમાં રોગ બગેરેને લીધે થનારો જ્યા જરા પણ નથી. હે ભૂત્યો ! ત્યાં આપનું કોઈ જ વળતું નથી. એટલા માટે આ લોકમાં માણુસો ઘરડા થાય છે તેમ ત્યાં કોઈ પણ ઘરડું થતું નથી તેથી આપનાથી જોઈ ત્યાં બીજું નથી. જીલદું ભૂખ ને તરસ જનેને પાર કરી તે પુરુષ શોકને તરી જ્યા છે ને માનસિક હૃદાયથી જુદ્ધકારો પાખી તે દિવ્ય સ્વર્ગલોકમાં આનંદ પામે છે. ૧૨

**અન્તું વરદાન-સ્વર્ગનાં સાધનરૂપ અભિવિદ્યા**

સ ત્વમગ્રિંસ્કર્યમધ્યેષિ મૃત્યો પ્રભૂહિ ત્વ ઽશ્રદ્ધાનાય મહામ્ર |  
સ્વર્ગલોકા અમૃતત્વં ભજન્ત એતद્દ્વિતીયેન ઘૃણો વરેણ ॥ ૧૩ ॥

મૃત્યો=હે ભૂત્યુદેવ ! સ: લ્બમ्=તે આપ; સ્કર્યમ् અગ્રિમ=ઉપયુક્ત સ્વર્ગપ્રાપ્તિના સાધનરૂપ અભિવિદ્યા, અધ્યેષિ=જાળો છો; (તેથી) લ્બમ्=આપ, મહામ્ર=મને, શ્રદ્ધાનાય=શ્રદ્ધાળુને (તે અભિવિદ્યા), પ્રભૂહિ=સારી શીતે સમજલીને કહો; સ્વર્ગલોકા=સ્વર્ગમાં રહેનારા, અમૃતત્વમ=અમરત્વને, ભજન્તે=પામે છે (તેથી) એતત્=આ, દ્વિતીયેન વરેણ=ખીલ વરદાનરૂપે; ઘૃણો=(હું) માણું જું. ૧૩

હે ભૂત્યો ! આપ સ્વર્ગનાં સાધનરૂપ અભિનો જાળો।

छा, तो ते श्रद्धाणु ऐवा मने तेनुं वर्णन करी तेनुं माहात्म्य कही संलग्नावे। ( कै जेनाथी ) स्वर्गे ने प्राप्त थयेला पुरुषो। अभृतत्वने प्राप्त करे छे. भीज वरदानथी ( स्वर्गे ना साधन-इप्प ए अभिविद्याने ) हुं माणुँ छुँ. १३

**आच्यः** : हे मृत्यो ! आप जोवा गुणवाणा स्वर्गाभिना साधनइप्प अभिने जाणु। छो तथो स्वर्गना अलिलापी ऐवा मने ते कहो कै ले अभिना चयनथी-संस्कारथी-स्वर्गे ते पामेला पुरुषो अर्थात् स्वर्गे ओ जेमना थोडे छ ऐवा यजमान-गुणु अभृतत्व-अभरता अर्थात् देवपण्याने पामे छे. भीज वरदानथी हुं आ अभिविद्यान माणुँ छुँ. १३

ओ संबोधी यमराज उहे छे :

प्रते ब्रवीमि तदु मे निबोध स्वर्ग्यमस्मि नचिकेतः प्रजानन् ।  
अनन्तलोकासिमयो प्रतिष्ठां विद्धि त्वमेतं निहितं गुहायाम् ॥१४

नचिकेतः=हे नचिकेता ! स्वर्ग्यम् अभिम्=स्वर्गे आपनारी अभिविद्याने; प्रजानन्=सारी रीते जाणुनारो हुं, ते प्रब्रवीमि= तमने सारी रीते कही जतावुँ छुँ; तत् उ मे निबोध=तेने ( तमे ) मारी पासेथी सारी रीते समलु लो; त्वम् एतम्=तमे आ अभि( विद्या )ने, अनन्तलोकासिम्=अविनाशी लोकनी आसि करावनारी, प्रतिष्ठाम्=तेना आधार-स्वरूप, अयो=साते, गुहायाम् निहितम्=भुक्षिद्वप्प गुहामां छुपायेली, विद्धि=जाणो। १४

हे नचिकेता ! स्वर्गे आपनारा ते अभिने सारी रीते जाणुनारो हुं तेने उपदेश करुँ छुँ, ते मारी पासेथी तुं सारी रीते समलु लो. ए अभिने तुं अनंतलेकनी आसि करावनार, तेना आधारइप्प अने भुक्षिद्वप्पी गुहामां रहेलो। जाणु. १४

**आच्यः** : आ मृत्युनी प्रतिश्च छे. हे नचिकेता ! जेना माटे ते-

आर्थना करी हुती ते स्वर्ग्य—स्वर्गनी ग्रामि थवामां डितङ्कारक  
अथर्व स्वर्गना साधनैक अभिने तुं एकाग्रचित् थई भारी वाणीयी  
सारी पेट जाणी ले. तेने सारी रीते जाणुनारो—तेनो विशेषश ॥५॥  
तारा प्रति तेनुं वण्णन करुं हुः, ‘हुं कहुं हुः’ ‘तु तेने जाणी दे !’  
आ वाक्ये शिष्यनी खुद्धिनुं समाधान करवाने भाटे छे. हेवे ए  
अभिनी स्तुति करे छे. स्वर्गलोकैकैप इणनी ग्रामि साधन तथा  
विराटैकैपथी ते अभि जगतानो आश्रय छे. मेरे क्षेला आ अभिने तुं  
खुद्धिमानं पुरुषोनी खुद्धिमां रहेलो हेवानुं जाणु. १४

लोकादिमग्नि तमुवाच तस्मै या इष्टका यावतीर्वा यथा वा ।  
स चापि तत्प्रत्यवद्यथोक्तसथास्य मृत्युः पुनरेवाह तुष्टः ॥१५॥

तम् लोकादिम्=ते स्वर्गलोकना हेतुैक, अग्निम्=अभिविघ्नानो,  
तस्मै उवाच=तेने ( नविक्षेताने ) उपहेश आप्ये, या वा यावतीः=तेभां  
हुः वजेरे अनाववा भाटे जे के ने ज्ञेत्रली, इष्टकाः=हिंट वगेरेनी  
आवश्यकता हेत्य छे, वा यथा=ते जे रीते तेनुं चयन करवामां आवे  
छे—तेने जाहृववामां आवे छे ( ते सर्वं वाता पणु अताववामां आवी ),  
च खः अपि=ते नविक्षेताये पणु तत् यथोक्तम्=ते ( उपहेश ) नेवा  
रीते सांभाष्यो हुतो, अराधर तेवी जे रीते समज्जने, प्रत्यवदत्=यम-  
राज्जने कडी संलग्नाये. अथ=त्यार पठी, मृत्युः अस्य तुष्टः=यमराज  
तेना पर संतुष्ट थईने, पुनः एव आह=इरीथी योद्या. १५

ऐटले यमराजे स्वर्गाद्विलोकेना आहि कारणैकैप ते  
अभिनुं तथा तेनुं चयन—संस्कार करवामां ज्ञेवी अने ज्ञेत्रली  
हिंटोनी आवश्यकता हेत्य छे ने जे रीते तेनुं चयन करवामां  
आवे छे ते सर्वंनुं वण्णन नविक्षेता आगण कसुः; ने नविक्षेता  
ये पणु अराधर तेवी जे रीते यमराज्जने कडी संलग्नायुः.  
आथी प्रसन्न थई कृतीथी मृत्युैकपी यमराज योद्याः १५

ભાગ્ય : પુરાજ કૃતીથી પણ કર્મને જ વપાણે છે : નેહે નણ-વાર નાચિદેત અભિનું ચચન કર્યું હોય તે ત્રિણાચિદેત કહેવાય. અથવા તો તેને જાણુનારે તે તેનું અધ્યયન અને અનુધાન કરનારે ત્રિણાચિદેત ગણ્યાય છે. તે ત્રિણાચિદેત માતા, પિતા અને આચાર્ય આ નહે સાથે સંખ્યાંધ પામી અર્થાત् વિધિપૂર્વક માતા વગેરે પાસેથા શિક્ષણ પામી; શાંતિ પામે છે. કેમ કે એક જીજુ શુતિથી તેમના તરફથી મળેલો બોધજ ધર્મજાનની પ્રામાણિકતામાં હેતુ મનાયો છે; જેમ કે માતા-પિતા તેમ જ આચાર્ય પાસેથી બોધ પામેલો પુરુષ કહે, ' નગેર શુતિથી જગ્યાય છે. અથવા વેદ, રમતિ અને શિષ્ટ પુરુષો પાસેથા અથવા તો પ્રત્યક્ષી, અનુમાન અને આગમથી ( સંખ્યાંધ પ્રાપ્ત કરીને ) થન, અધ્યયન અને દાન, આ નહે કર્મને કરનારે પુરુષ જ-મ અને મૃત્યુને તારી જય છે—તેમને ઓળંગી જય છે; કેમ કે તેણે ( તે વેદ વગેરે અથવા પ્રત્યક્ષાદિ ) પ્રમાણોથી સિદ્ધિ થતી પ્રત્યક્ષ જોઈ છે. વળી ' બહાજજ ' અને એટલે અન્ના; અર્થાત્ હિરણ્યગામાંથી ઉત્પન્ન થશેલો હોય તે અન્નજ કહેવાય. આ પ્રમાણે કે અન્નજ છે અને ' જ ' એ જાણુનારે પણ છે તેને ' બહાજજ કહેવામાં આવે છે, તે સર્વજ છે. ધોતન અર્થાત્ પ્રકાશ વગેરેને લીધી દેવ કહેવાય છે તે દેવને ને જ્ઞાનાદિ શુણ્ણોવાળો હોવાથી ઈજ અર્થાત્ સ્તુતિ કરવા યોગ્ય છે, તેને શાસ્ત્રથી જાણીને અને ' નિચાય ' એટલે આત્મભાવથી જોઈને પોતાની બુદ્ધિથી પ્રત્યક્ષ થનારી આ આત્મ-તિક શાંતિને અર્થાત્ ઉપરતિને પામે છે, એટલે કે શાન અને કર્મના સમુચ્ચયનું અનુમાન કરવાથી વેરાજ પદને પ્રાપ્ત કરે છે. ૧૭

હવે અભિવિજાન અને તેના ચચનનો લથા આ પ્રકરણને ઉપસંહાર કરે છે :

ત્રિણાચિકેતસ્યમેતદ્વિદિત્વા ય એવં વિદ્વા-શિનુતે નાચિકેતસ્મુ ।  
સ મૃત્યુપ્રાણાન્પુરતઃ પ્રણોદ્ય શોકાતિણો મોદતે સ્વર્ગલોકે ॥૧૮॥

એતत્ ત્રયમ्=ઈટેતું સ્વરૂપ, સંગ્રહાઅને અભિના ચયનનો વિધિ આ નણે વાતોને, વિદિત્વા=જાણુને, ત્રણાચિકેતઃ=ત્રણુ વાર નાચિકેત અભિવિદ્યાનું અનુષ્ઠાન કરનારો અને યઃ એકમ्=જે કોઈ પણ આ પ્રમાણે; વિદ્ધાન्=જાણુનારો પુરુષ, નાચિકેતમ्=આ નાચિકેત અભિનું; ચિનુતે=ચયન કરે છે; સઃ મૂલ્યપાદાન्=તે માણુસ મૃત્યુના પાશને; પુરત્સ પ્રગોદ્ય=પોતાની આગળ જે ( મનુષ્યશરીરમાં જ ) કાપી નાખીને; શોકાતિગઃ=શોકથી તરી જઈને; મોદત્તે=સ્વર્ગલોકમાં આનંદ અનુભવે છે. ૧૮

અભિનું ચયન કરવા માટે કયા આકારની, કેવી અને કેટલી ઈટો હેવી જોઈએ; તેમ જ અભિનું ચયન કઈ રીતે કરું; આ ત્રણે વાતોને જાણી ને રાની પુરુષ ત્રણુ વાર નાચિકેત અભિવિદ્યાનું નિષ્ઠામ લાવુથી અનુષ્ઠાન કરે છે એટલે કે અભિનું ચયન કરે છે તે શરીર પડતાં જ પહેલાં ( જ+મ ) મૃત્યુના પાશને તોડી નાખીને શોકરહિત થઈ અતે સ્વર્ગલોકના ( અવિનાશી ઉધ્વે લોકના ) આનંદનો અનુભવ કરે છે. ૧૮

**ભાષ્ય :** ત્રણાચિકેત અભિના ઉપર કહેલ ત્રણુ વિધિઓને અર્થાત् જે ઈટો નેટલી અને નેવી હેવી જોઈએ ને નેવી રીતે અભિનું ચયન કરું જોઈએ-આ ત્રણુ વાતોને સમજી લઈ તે અભિને આત્મસ્વરૂપે જાણુનારો જે વિદ્ધાન અભિ-કૃતું ચયન કરે છે ને તેની સાધના કરે છે તે અધમ્, અજ્ઞાન અને રાગદ્વિષાદ્વિપ મૃત્યુનાં ખંધનોનો દ્રોહપાત થયા પૂર્વે જ ત્યાગ કરી માનસિક હુઃખોથી મુક્ત થઈ, સ્વર્ગમાં અર્થાત् વૈરાજ લોકમાં વિરાટ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થવાથી આનંદ અનુભવે છે. ૧૮

**એવ તેજમિનચિકેતઃ** સ્વર્ગર્યો યમભૂતીશા દ્વિતીયૈન અરેણ ।  
**એતમશ્રી** તવૈવ પ્રવાસ્યાન્તિ જનસસ્તુતીઃ બર્દ્ધાચિકેતો વૃણીષ ॥

નાચિકેતઃ=કે નચિકેતા । એવઃ તે=આ દાખને ધરાવેલ, સ્વર્ગ:

अग्निः=स्वर्ग आपनारी अग्नि (विद्वा) ॲ. यम् द्वितीयेन वरेण अबृणीथाः=  
ज्ञेन तमे भीज वरथी मागी हुती; एतम् अग्निन्=आ अग्निने  
( हुवेथी ), जनासः=माणुसो, तव एव=तमारा ज्ञ नामथी, प्रवद्यन्ति=  
उत्था करशे; नचिक्रेतः=हे नचिक्रेता, तृतीयम् वरं बृणीष्व=( हुवे तमे )  
त्रीजुं वरदानं मागी लो. १६

हे नचिक्रेता ! ते भीज वरदानथी ज्ञेनी माणेही करी  
हुती ते आ स्वर्गनी आसि माटेनुं साधनृप समिविशान  
में तने आप्यु. द्वाके। आ अग्निने तारे ज्ञ नामे संषोधशे.  
हे नचिक्रेता ! वणी तुं त्रीजुं वरदानं मागी लो. १६

भाष्य : हे नचिक्रेता ! तारा भीज वरथी ते ज्ञे अग्निनी  
माणेही करी हुती, ज्ञेने भाटे ते प्रार्थना करी हुती ते स्वर्गाप्सितुं  
साधनभूत आ अग्निविशानृपी वर में तने आप्यु. आ अमाणु  
उपर कडेला अग्निना विशाननो उपसंहार करवामां आप्यो, ऐट्युं  
ज्ञ नहीं पणु द्वाके। आ अग्निने तारा नामे ज्ञ संषोधशे, तारा  
पर हुं प्रसन्न थयेदेव लोकाथी में तने आ चोप्युं वरदानं आप्यु.  
हे नचिक्रेता ! हुवे वणी तुं त्रीजुं वरदानं मागी लो; कारणु के ते आप्या  
विना हुं ऋणी-हेषुदार ज्ञ हुं ओम कडेवानो आशय ॲ. १६

विधि-प्रतिषेध ज्ञ ज्ञेनां प्रयोजन छे ओवा उपर कडेला मंत्र-  
आक्षणु वडे आ ऐ वरथी सूखवायेली वस्तु ज्ञ शातव्य अर्थात्  
ज्ञानवा योज्य छे. आत्मतत्त्व विषयक यथार्थं शान आनो। विषय  
नथी. हुवे ज्ञे विधि-प्रतिषेधनो विषय छे. आत्मामां किया, कारक अने  
इनो। अध्यारोप करवो ए ज्ञ ज्ञेनुं लक्षणु छे तेम ज्ञ ज्ञे संसारनुं  
भीजस्वरूप छे ते स्वालाविक अशाननी निष्ठति भाटे तेनाथी विपरीत  
अज्ञातमैक्य शान विषे हुवे कडेवानुं छे. ओ ज्ञान किया, कारक अने  
इनो। अध्यारोपृप्य लक्षण्यथी शून्य तेम ज्ञ आत्मतिक निःश्रेयसरूप  
प्रयोजनवानुं छे. ओना भाटे ज्ञ आगुणना अंथनो। आरंभ हुवे

કરવામાં આવે છે. આ જ વાતમે આજ્ઞાયિકા વડે વિસ્તૃત કરી જગ્યાવે છે કે, ત્રીજી વરથી પ્રામુખ થનારા આત્મજ્ઞાન વિના બીજી વરની પ્રાપ્તિથી પણ અકૃતાર્થતા જ છે એટલે કે કૃતાર્થતા નથી; તેમ કે અગાઉ હલેલાં કર્મવિષયક સાધ્ય-સાધન લક્ષ્યણ તેમ જ આનિત્ય કુળાથી જે વિરક્તા થઈ ગયો હોય તે જ પુરુષનો આત્મજ્ઞાનમાં અધિકાર છે. તેથી તેમની નિંદાને માટે પુત્રાદિના વિચારથી નચિદેતાને લલાચાવવામાં આવે છે.

‘હે નચિદેતા ! તમે ત્રીજું વરદાન માર્ગી લો. ’ આ પ્રમાણે યમે કલ્યાથી નચિદેતા બોલ્યા :

### ત્રીજું વરદાન—આત્મરહસ્ય

યેયં ગ્રેતે વિચિકિત્સા મનુષ્યેઽસ્તીત્વેકે નાયમસ્તીતિ ચૈકે ।  
એતદ્વિદ્યામનુશિષ્ટસ્ત્વયાહં વરાણમેષ વરસ્તૃતીયઃ ॥ ૨૦ ॥

ગ્રેતે મનુષ્યે=મરી ગયેલા ભાષુસના વિષયમાં, યા હૃદયમ=જે આ, વિચિકિત્સા=સંશય છે, એકે (આહુઃ) અયમ् અસ્તિ ઇતિ=કોઈ તો એમ કહે છે કે મૂઢા પણી આ આત્મા રહે છે, ચ એકે (આહુઃ) ન અસ્તિ ઇતિ=ને વળી કોઈ એમ કહે છે કે નથી રહેતો, ત્વયા અનુશિષ્ટઃ=આપતી ભારકૃત ઉપરેશ પાભી, અહમ् એતત વિદ્યામ્=હું એતો નિર્ણય સારી ચેઠે સમજુ લઉં, એષઃ વરાણમ્=આ જ તરણું વરદાનમાંથી, તૃતીયઃ વરઃ=ત્રીજું વરદાન છે. ૨૦

મરી ગયેલા ભાષુસોના વિષયમાં જે એવો સંદેહ છે કે કોઈ તો કહે મરણું પામ્યા ખાદ આ આત્મા ‘રહે છે’ ને કોઈ કહે છે કે ‘નથી રહેતો.’ x આપની ભારકૃત

x મરણું પામ્યા પણી આત્માનું અસ્તિત્વ રહે છે કે નહીં; આ સંખ્યાધમાં નચિદેતાને પોતાને કોઈ સંદેહ નથી. આંદ્રાને યરની દક્ષિણાદ્રાયે બાપા ધરડી ગાયો આપી રહ્યા છે એવું જોઈને નચિદેતાને

ઉપદેશ ચામી હું એનો નિષ્ણાય સારી ચેઠે સમજુ લઈં.  
ત્રણોય વરદાનમાંથી આ જ મારું અભીષ્ટ ત્રીજું વરદાન છે. ૨૦

(નિયંત્રણનો મહેરવપૂર્ણ પ્રશ્ન સાંલળાને યમરાને મનમાં ને  
મનમાં તેનાં વખાણ કર્યાં ને આ નિષ્ઠિકુમાર બાળક હેવા છતાંય  
ધર્મા પ્રતિશાળા છે, ગુમ રાખવા જેવા વિષયને કેવી રીતે જ્ઞાનવા  
ચાહે છે ? પરંતુ આત્મતર્વ યોગ્ય અધિકારીને જ જ્ઞાનવિદું જોઈએ;  
અનાધિકારીને આત્મતર્વનો ઉપદેશ કરવો હાનિકારક થાય છે; એટલા  
માટે પ્રથમ પાત્રની પરીક્ષા કરવાની આવર્ષયકતા છે. એવા વિચારથી  
યમરાને આ તત્ત્વની કંડિનતાનું વર્ણન કરી નિયંત્રણને વિચલિત  
કરવાનો વિચાર કર્યો. )

**ભાગ્ય :** મરણ પામેલા માણુસના વિષયમાં જે એવી સંદેહ છે

સ્પૃષ્ટપણે કહ્યું હતું કે આવી ગાયોનું દાન કરનારા આનંદરહિત  
(અનન્દઃ) નરકાદિ લોકોને પામે છે, એવી જ રીતે ખીજી વરમાં  
નિયંત્રણાચે સ્વર્ગનાં સુખોનું વર્ણન કરીને સ્વર્ગઆપ્તિના સાધનરૂપ  
અભિવિઘાના ઉપદેશ માટે યમરાજને પ્રાર્થના કરી હતી. આથી  
ઓનું સિદ્ધ થાય છે કે, તે સ્વર્ગ અને નરકમાં માનતો હતો. સ્વર્ગ—  
નરક વગેરે લોકોની પ્રાપ્તિ મૂળા પણી જ થાય છે. આત્માનું અસ્તિત્વ  
ન હોય તો આ લોકોની પ્રાપ્તિ કોને થાય કે એટલા માટે જ આહી  
નિયંત્રણાચે પોતાનો મરત ન જતાવતાં કહ્યું છે કે, કેટલાકો મરણ  
પુછી આત્માનું અસ્તિત્વ માને છે ને કેટલાકો નથી માનતા. પ્રશ્નનો  
આ એક એવા સુંદર પ્રકાર છે કે, જેના ઉત્તરમાં આત્માની નિષ્ઠાસરાના,  
આ એક એવા સુંદર પ્રકાર છે કે, જેના ઉત્તરમાં આત્માની પ્રાપ્તિનાં સાધનોનું વિવરણ  
તેનાં સ્વરૂપ, ગુણ અને પરમાત્માની પ્રાપ્તિનાં સાધનોનું વિવરણ  
આપોઆપ જ આવી જય છે. એટલા માટે આ પ્રશ્ન આત્મરાનાન  
વિષયક છે, પણ આત્માના અસ્તિત્વ વિષે સંદેહજનક નથી. તૈતીરીય  
આણુમાં નિયંત્રણનો જે ધતિહાસ મળે છે તેમાં તો નિયંત્રણાચે નીળ  
વરમાં પુનર્મૃત્યુ (૦૪.૫-મૃત્યુ) પર વિજ્ઞય પામવા માટેનું મુક્તિનું  
ઝાધન જણવા ચચ્છયું છે (તૃતીય વૃણાષ્વેતિ પુનર્મૃત્યોમેઽપચિતિ ત્રૂહિ ).

કે ક્ષેત્રલાંડો તો એમ કહે છે કે શરીર, ધ્યાન, મન, પુણિથી અતિ-  
રિક્ત અન્ય દેહ સાથે સંબંધ રાખનારો આત્મા રહે છે ને ક્ષેત્રલાકું  
એમ કલેલું છે કે, એવો ઝોઈ આત્મા રહેતો નથી. આથી એના  
વિષયમાં અમને પ્રત્યક્ષ અથવા તો અનુમાનથી ઝોઈ નિશ્ચિત જ્ઞાન  
થતું નથી; ને વળી પરમ પુરુષાર્થ આ વિજ્ઞાનને જ અધીન છે તેથી  
આપની પાસોથી એના વિષેની માહિતી મેળવીને હું એને જાણી  
શકું. ભાર્તા નાણે વરદાનોમાં ભાગવા ભાટેનું આ એક જ વરદાન  
બાકી રહ્યું છે. ૨૦

આ (નચિકેતા) નિઃશ્વેષસના સાધનરૂપ આત્મજ્ઞાનને ગોપય  
પૂર્ણ રીતે છે કે નહીં, આ વાતની પરીક્ષા કરવા ભાટે યમરાજે રહ્યું:

દેવैરત્રાપિ વિચિકિત્સિતં પુરા ન હિ સુવિજ્ઞેયમણુરેષ ધર્મઃ ।  
અન્ય વરં નચિકેતો વૃણીષ્વ મા ગોપરોત્સીરતિ મા સુજૈનમ् ॥૨૧

નચિકેતઃ=હે નચિકેતા, અત્ર પુરા=આ વિષયમાં અગાઉ, દેવૈ:  
અપિ=દેવતાઓએ પણ, વિચિકિત્સિતમ्=સંદેહ કર્યો હતો (પણ તેઓ  
પણ સમજુ શક્યા નહીં), હિ એષઃ ધર્મઃ અણુઃ=કેમ કે આ વિષય  
અતિ સૂક્ષ્મ છે; ન સુવિજ્ઞેયમ्=સહેલે સમજય તેવો નથી (માટે)  
અન્યમ् કરમ् વૃણીષ્વ=તમે ખીજું વરદાન મારી દે, મા મા ઉપરોક્તિઃ=  
ભારા પર દ્વારા આપુશો નહીં, એનમ્ મા=આ આત્મજ્ઞાન સંબંધી  
વરદાન મને, અતિસુજ=પાછું આપી દે. ૨૧

આ વિષયમાં અગાઉ દેવતાઓને પણ સંદેહ થયો  
હતો; કેમ કે આ સૂક્ષ્મ ધર્મ સહેલાઈથી સમજય તેવો નથી.  
હે નચિકેતા! તું ખીજું વરદાન મારી દે. આ વરદાન  
મેળવવા ભાટે ભારા પર દ્વારા આપીશ નહિ અર્થાતું ભારું  
કામ કરતાં તું મને રાકીશ નહિ. આ આત્મજ્ઞાન સંબંધી  
વરદાન મને પાછું આપી દે. ૨૧

आज्ञः आ आत्मतत्त्वना विषयमां पहेलां पूर्वकाणमां देवताओंचे पणु संशय कर्यो होतो. आ तत्त्वने सामान्य भाषुसे। समलू शक्ति तेम नव्ही; तेम के आ 'आत्मा' नाभवाणी धर्म अति सुखम् छे. एटला भाटे हे निर्दिता ! चोक्कल इण आपनार भीजु' झाई वरदान तु भागी ले. झाई लेणुद्दार पोताना लेणुद्दारने हणावे छे, तेम तु भारा पर हणाणु आणुश नहीं. आ वरदान तु भासा भाटे ज रहेला हे. २१

### निर्दितानी स्थिरता

देवैरत्रापि विचिकित्सितं किल त्वं च मृत्यो यन्न सुविशेयमात्थ । वक्ता चास्यत्वाद्गन्यो न लभ्यो नान्यो करस्तुल्य एतस्य कश्चित् ॥

मृत्यो=हे यमराज। स्वम् यत् आत्थ=आपे के ओम कहुँ दे, अत्र किल देवैः अपि=आ विषय पर देवताओंचे पणु विचिकित्सितम्=विचार कर्यो होतो ( परंतु तेओ निषुर्य ठरी शक्त्या नहीं )-न च सुविशेयम्=तेम ज आ सहेलाईथी समलू दे जाणी शक्ताय तेवो पणु नव्ही ( एटलुं ज नहीं ). च=ओ सिवाय, अस्य वक्ता= आ विषय कहेनारी पणु, चाहक्=आपना जेवो, अन्यः न लभ्यः=भीजे झाई भणे तेम नव्ही, ( अतः )=आथी भारी समज प्रभाष्ये तो, एतस्य तुल्यः=ओना जेवुं, अन्यः कश्चित्=भीजुं झाई पणु वरः न=परदान नव्ही. २२

हे यमराज ! आपे के ओम कहुँ दे, आ विषय पर देवताओंचे पणु विचार कर्यो होतो; परंतु तेओ निषुर्य ठरी शक्त्या नहिं; तेम ज आ विषय सहेलाईथी समलू दे जाणी शक्ताय तेवो पणु नव्ही ( एटलुं ज नहिं ); पणु आ विषय कहेनारी आपना जेवो भीजे डेई भणे तेम नव्ही. एटला भाटे भारी समज प्रभाष्ये तो ओना जेवुं भीजुं डेई पणु वरदान नव्ही, २२

**ભાષ્ય :** આ વિષયમાં ટેલતાઓએ પણ સાઈછ કર્યો હતો એમ હુમણું જ મેં આપની પાસેથી સાંભળ્યું છે. હે મૃત્યે! આ તરફ સહેલાઈથી ન જાણી શકાય તેવું હોવાથી આપ પણ તે મને કહેતા નથી; તેમ જ પંડિતાથી પણ ન જાણી શકાય એવો આ વિષય હોવાથી આ ધર્મના ઉપરેશ કરનારો ખીજો આપના જેવો ડેઢું પણ પંડિત શાખ્યો પણ મળો શકે તેમ નથી; વળી આ વર પણ નિઃશ્રેષ્ઠસ અથાત् મોક્ષની આપ્તિનું કારણ છે તેથી એના જેવો ખીજો ડેઢું પણ વર નથી; કેમ કે ખીજો બધાં વરદાન અનિત્ય કુળવાળાં છે. આ એનો અભિગ્રાય છે. ૨૨

નચિકેતાએ આ પ્રમાણે કહેવા છતાં ઇરીથી તેને પ્રલોભન આપતાં યમરાજ કહેવા લાગ્યા:

### અમૃતજ્ઞનું પ્રલોભન

શતાયુષः પુત્રપૌત્રાન્યુણીષ્વ બહૂન્યરૂપસ્તિહિરણ્યમશાન् ।  
ભૂમેર્મહદાયતનં વૃણીષ્વ સ્વયં ચ જીવ શરદો યાવદિચ્છસિ ॥ ૨૩॥

**શતાયુષः** પુત્રપૌત્રાન્યુણીષ્વ=બહૂન્યરૂપસ્તિહિરણ્યમશાન्, બહૂન્ય=ધણું ગાય વગેરે પણાને (તેમ જ), હસ્તિહિરણ્યમ=હાથી, સોનું અને; અશાન્ય વૃણીષ્વ=ઘોડાઓને માગી લેા; ભૂમે: મહત્ત્માન, આયતનમ્ય=ધણું વિસ્તારવાળા ભૂમંડળ(ના સામ્રાજ્ય)ને; વૃણીષ્વ=માગી લેા; સ્વયમ્ભુ ચ=ને તમે પોતે પણ, યાવત્ શરદઃ=જેટલાં વર્ષે સુધી; ઇચ્છસિ=ઇચ્છો; જીવઃ=જીવતા રહો. ૨૩

હે નચિકેતા! તુ સો વર્ષના આચુણ્યવાળા પુત્ર-પૌત્રાદિને, ગાય વગેરે ધણું પણાને તેમ જ હાથી, સોનું અને ઘોડાઓને માગી લે. વિશાળ ભૂમંડળ(તું સામ્રાજ્ય) પણ માગી લે, તેમ જ તુ પોતે પણ જેટલાં વર્ષ જીવવાને હુંબછતો હોય તેટલાં વર્ષ જીવ. ૨૩

**भाष्य :** सो वर्षे तुं ज्ञेमनुं आवृष्ट्य होय एवा शतायु पुन्, पौत्र माणी ले; तेभ ज्ञ गाय वगेरे धणुं पशु, हाथी अने सोनुं तथा घोडा अने पृथ्वीनुं भण्डान विस्तृत आयतन—आश्रय—मुद्ग अर्थात् राज्य माणी ले; पणु हुं पोते ज्ञे अद्यायु होय तो वजा आ अधां व्यर्थे ज्ञ छे—तेधी इहे छे; हुं पोते पणु ज्ञेट्हुं ज्ञववा धर्षते। होय तेट्हां पर्षे सुधी ज्ञवते। रहे; अर्थात् शरीर एट्के समय दिनिय समूहने धारणु करी रहे. २७

**एतत्तुल्यं यदि मन्यसे वरं वृणीष्व वित्तं चिरजीविकां च ।  
महाभूमौ नचिकेतस्त्वमेधि कामानां त्वा कामभाजं करोमि ॥२४॥**

नचिकेतः=हे नचिकेता। वित्तम् चिरजीविकाम्=धन, संपत्ति अने अनंत काणि सुधी रहेनारी आज्ञविकाने, यदि खम्=ज्ञे तमे, एतत्-तुल्यम्=आ आत्मज्ञानविषयक वरदान समान, वरम् मन्यसे=परने मानता हो तो, वृणीष्व=माणी ले, च महाभूमौ=तमे आ पृथ्वी-लोकमां, एधि=भण्डान समाट अनो; त्वा कामानाम्=(हु) तमने सर्व उत्तम लोगोमानां=कामभाजम्=अृति उत्तम लोगोने लोगवनार, करोमि=धनावी दृष्टि हुं. २४

ओना सरभुं ज्ञ खीजुं ज्ञे डोई वरदान तुं समज्जतो। होय तो तेने, अथवा धनसंपत्ति अने अनंतकाणि सुधी रहेनारी आज्ञविकाने तुं माणी ले. हे नचिकेता। आ विशाण भूमिमां तुं वृक्षि पाम. हुं तने तारी मरज्ज प्रभाणे कामनाएने लोगवनारे। अनालुं. २४

**भाष्य :** आ उपर छहेला वरदानना ज्ञेवुं ज्ञे तुं खीजुं डोई वरदान समज्जतो। होय तो ते पणु माणी से. एट्हुं ज्ञ नहीं; पणु धन अर्थात् पुष्कण सुवण्णुं अने रहन वगेरे तथा ते धननी साधे चिरकाण पर्यंत रहेनारी ज्ञविका पणु माणी ले. वहु तो शुं पणु हे नचिकेता। आ विशाण भूमिमां तुं राज थईने वृक्षिने पाम. हुं तने हैवी तम

જ ભાતુષી સર્વ કામનાઓને તારી ભરળુ પ્રમાણે ભોગવનારે અચાલી  
દઉ છું; કારણુ કે હું સત્યસંકલ્પને પાર પાડનારે દેવતા છું. ૨૪  
યે યે કામા દુર્લભા મર્યલોકે સર્વાંકામા છન્દન્દતઃ પ્રાર્થયસ્વ ।  
ઇસા રામાઃ સરથાઃ સત્તૂર્યાં ન હીદ્વશા લમ્ભનીયા મનુષ્યૈઃ ।  
આમિર્મલાત્તામિઃ પરિચાર્યસ્વ નચિકેતો મરણ માનુપ્રાક્ષીઃ ॥૨૫॥

યે યે કામાઃ=જે ને ભોગો, મર્યલોકે=મનુષ્યલોકમાં, દુર્લભાઃ=દુર્લભ  
છે, સર્વાંકામાનું=તે સર્વ ભોગોને, છન્દતઃ પ્રાર્થયસ્વ=ભરળુ પ્રમાણે  
માગો લે, સરથાઃ સત્તૂર્યાઃ ઇમાઃ રામાઃ=રથ અને વિવિધ પ્રકારના  
વાજિંત્રો સાથે આ સ્વર્ગની અર્પસરાઓને ( પોતાની સાથે લઈ જ ),  
મનુષ્યૈઃ હીદ્વશાઃ=મનુષ્યોને આવી ખીઓ, નહિ લમ્ભનીયાઃ=( કદાપિ )  
પ્રામ થઈ શકતી નથી. મત્તુલ્તામિઃ=મારાથી અપાયેલી, આમિઃ=આ  
ખીઓથી, પરિચાર્યસ્વ=તું તારી સેવા કરાવ, નચિકેતઃ=હે નચિકેતા ।  
મરણમૂ=મૂળા પણી આત્માનું શું થાય છે આ વાત, મા અનુપ્રાક્ષીઃ=  
પૂછીશ નહીં. ૨૫

મનુષ્ય લેકમાં ને ને ભોગો દુર્લભ છે તે અધા  
લોગો તારી ભરળુ પ્રમાણે માગી લે. અહીં રથ અને  
વિવિધ પ્રકારના વાજિંત્રો સાથે આ પ્રમદાઓ છે. આવી  
ખીઓ મનુષ્યોને પ્રામ થઈ શકતી નથીજ. મારા વડે  
અપાત્તી આ કામિનીઓ પાસે તું તારી સેવા કરાવ; પરંતુ  
હે નચિકેતા । તું ભરણુ સંખ્યાંકી પ્રશ્ન પૂછીશ નહિ. ૨૫

ભાષ્ય : આ મર્યલોકમાં ને કામનાઓ-ઈચ્છા યોગ્ય  
નસ્તુઓ-દુર્લભ છે તે અધી ઈચ્છા અનુસાર માગી લે. તદુપરાંત આ  
રામાઓ ( પુસ્તો સાથે ને રમણુ કરે છે તે ‘રામા’ કહેવાય છે, એવી )  
આ દ્વિષ્ય અર્પસરાઓ સરથાઃ-રથો સહિત અને સત્તૂર્યઃ-વાજિંત્રો  
સહિત તૈયાર છે. અમારા નેવા દેવતાઓની કૃપા વિના આ અર્થાત

આવી ખીચો મરણુધર્મા મનુષ્યોને પ્રાપ્ત થઈ શકતી જ નથી. મારા વડે અપાયેલી આ દાસીઓ પાસે તારા પગ ધોવડાવવાદ્વપ સેવા કરાવ; પરંતુ હે નચિકેતા! મૂળા પછી જીવાતભા રહે છે એ નથી રહેતો એવો, હાગડાના દાંતોની પરીક્ષા કરવા જેવો મરણુસ'ખ'ધી પ્રશ્ન પૂછીશ નહીં. તારા જેવાએ આવો પ્રશ્ન કરવો ઉચિત નથી. ૨૫

એ રીતે નચિકેતાને લલચાવ્યો છતાં મોટા સરોવરની પેઢે કુદ્ધ થયા વિના નચિકેતાએ ઠણું :

### નચિકેતાની નિષ્કામતા।

શોમાવા મર્યાસ્ય યદન્તકૈતત્ત્વબેન્દ્રિયાણાં જરયન્તિ તેજઃ ।  
અપિ સર્વ જીવિતમલ્યમેવ તવૈવ વાહાસ્તવ નૃત્યગીતે ॥ ૨૬ ॥

અન્તક=હે થમરાજ ! ( નેનું આપે વર્ણન કરું તે ) શોમાવા=ક્ષણુલાંગુર લોગ ( ને તેનાથી આપ થનારાં સુખ ), મર્યાસ્ય=મનુષ્યના, સર્વેન્દ્રિયાણામ्=અંતઃકરણ સહિત સર્વ ઇદ્રિયોનું, યત્ તેજઃ=જે તેજ છે, એતત્=એને, જરયન્તિ=ક્ષીણું કરી નાખે છે; અપિ સર્વમ्=એ ઉપરાંત સધળું, જીવિતમ्=આયુષ્ય, લદેને તે ગમે. તેટલું કાં ન હોય; અલ્યમ् એવ=આશ્રું જ છે, માટે; તવ વાહાઃ=આ આપનાં રથ વગેરે વાહનો, અને નૃત્યગીતે=આ અપસરાઓનાં નાચગાન, તવ એવ=આપની પાસે જ રહેવા હો ( મારે જોઈતાં નથી ). ૨૬

હે થમરાજ ! આ લોગ ‘આવતી કાલે રહેશે કે નહિ’—એવા પ્રકારનાં ( અનિર્ણય ) છે અને સધળી ઇદ્રિયોના તેજને જરૂરું કરી નાણે છે. આ સધળું આયુષ્ય પણ ઘણું થાડું જ છે. આપનાં વાહન અને નાચ-ગાન એ ખંડું આપની પાસે જ રહેવા હો ( મારે એ જોઈતાં નથી ). ૨૬

ભાજ્ય : આપે જે જોગનો ઉલ્લેખ કર્યો છે તે તો શોભાવ છે—જેમનો ભાવ અર્થાત અસ્તિત્વ ‘કાલે રહેશે કે નહીં’ એ પ્રમાણે

સદેહયુક્ત હોય તે ખોલાવ કહેવાય. વળી હે અંતક-હે મૃત્યે। આ અભ્યસરા વગેરેનો બોગ મનુષ્યોની સર્વ ઉદ્દિયોના તેજને ક્ષીણ કરી નાભે છે; તેથી ધર્મ, વીર્ય, પ્રજ્ઞા, તેજ અને ધર્મ વગેરેનો ક્ષય કરનાર હોવાથી એ બોગ અનર્થના હેતુરૂપ જ છે. વળી આપ ને દીર્ઘાયુષ્ય આપવા ઉચ્છો છો તેના વિષયમાં પણ સાંભળો. અલ્લાનું સંપૂર્ણ જીવન અર્થાત્ આયુષ્ય છે તે પણ અહેપ જ છે, તો પછી અમારા નેવાના દીર્ઘ જીવનની તો વાત જ ક્યાં રહી? એટલા માટે આપનાં રથ વગેરે વાહનો અને નાચગાન એ બધું આપની પાસે જ રહેવા હો (મારે એ જોઈતાં નથી). ૨૬

વળી—

ન વિસેન તર્પણીયો મનુષ્યો લપ્સ્યામહે વિત્તમદ્રાક્ષમ ચેત્તા ।  
જીવિષ્યામૌ યાવદીશિષ્યસિ ત્વં વરસ્તુ મે વરણીયઃ સ એવ ॥૨૭

મનુષ્યः=મનુષ્ય, વિસેન=ધનથી, તર્પણીયઃ ન=ક્ષયારેય તૃમ કરી શકાતો નથી; ચેત્ત=જ્યારે ( અમે ), ત્વા અદ્રાક્ષમ=આપનાં દર્શન કરી લીધાં છે, ( ત્યારે ) વિત્તમ્=ધનને, લપ્સ્યામહે=( તો અમે ) અવશ્ય પામીશું જ; ( અને ) ત્વમ् યાવત् આપ જ્યાં સુધી, ઈશિષ્યસિ=શાસન કરતા રહેશો, ત્યાં સુધી તો, જીવિષ્યામઃ=અમે જીવતા જ રહીશું ( માટે એ બધાને માગવાનું પ્રયોજન જ શું છે, તેથી ); મે વરણીયઃ વરઃ તુ=મારે માટે માગવાલાયક વર તો, એવ=તે ( આત્મજ્ઞાન ) જ છે. ૨૭

માણુસને ધનથી તૃમ કરી શકાતો નથી, જ્યારે હુંવે આપનાં દર્શન કરી લીધાં છે, તો ધન તો અમે અવશ્ય પામીશું જ. આપ જ્યાં સુધી શાસન કરતા રહેશો ત્યાં સુધી અમે જીવતા પણ રહીશું જ. ( માટે ધન, આયુષ્ય વગેરે માગવાનું પ્રયોજન જ શું છે, તેથી ) મારે માગવાલાયક વર તો તે ( આત્મજ્ઞાન ) જ છે. ૨૭

માણ્ય : મનુષ્યને પુષ્કળ ધનથી પણ તૃમ કરી શકાતો નથી:

લોકમાં ધનની પ્રાપ્તિ છેઠને પણ તુમ કરનારી થઈ હોય એવું જોવામાં આવ્યું નથો. હવે જ્યારે અમે આપનાં દર્શાન કરી લીધાં છે ત્યારે જો અમને ધનની લાલસા થશે તો ધન તો અમે પ્રાપ્ત કરી જ લઈશું; એ જ પ્રમાણે દીર્ઘાયુષ્ય પણ મેળવી લઈશું. જ્યાં સુધી આપ થમના પદ પર રહી શાસન કરશો ત્યાં સુધી અમે પણ જીવતા રહીશું. ભલા ડેઢ પણ માણુસ આપના સંપર્કમાં આવ્યા પછી અન્પાદુ કે અન્પ ધનવાળો કઈ રીતે રહી શકે? પરંતુ વરદાન તો આત્મવિશાન સંબંધી જે માણું છે તેજ માગવાનું રહે છે. ૨૭

નોંધ—

अजीर्यताममृतानामुपेत्य जीर्यन्मर्यः क्षधःस्थः प्रजानन् ।

अभिध्यायन्वर्णरतिप्रमोदानतिदीघे जीविते को रमेत ॥ ૨૮ ॥

जીર્યન् મર્યઃ=આ મનુષ્ય જીવનારે અને મરણધર્મ છે, પ્રજાનન्=આ તરફને સારી રીતે સમજનારો, ક્ષধःસ્થः=મનુષ્યલોકનો નિવાસી, કः=દ્વારા ( એવો ) માણુસ છે ( કે ને ), અજીર્યતામુ=ધડપણુથી રહિત, અમૃતાનામુ=ન મરનારા ( આપના જેવા ) મહાત્માઓનો, ઉપેત્ય=સંગ પામીને પણ, વર્ણરતિપ્રમોદાન= ( ખીચોનાં ) સૌંદર્ય, કીડા અને આમોદપ્રમોદનું, અભિધ્યાયન્=વારંવાર ચિંતન કરતો, અતિદીઘે=ધણ્ણા સમય સુધી, જીવિતે=જીવિત રહેવામાં, રમેત=આનંદ માનશે. ૨૮

આ મનુષ્ય જીવનારે અને મરણધર્મ છે એવા તરફને સારી રીતે સમજનારો મનુષ્ય લોકનો એવો ક્યો માણુસ છે કે, જે આપણા જેવા અજર અને અમર મહાત્માઓનો સંગ પામીને પણ ખીચોનાં સૌંદર્ય, કીડા અને આમોદપ્રમોદનું વારંવાર ચિંતન કરતો ધણ્ણા સમય સુધી જીવિત રહેવામાં આનંદ માનશે? ૨૮

**ભાષણ :** વધની હાનિઃપ જીર્યતાને પ્રાપ્ત નહિ થનારો અમર એવા દેવતાઓની સમીપ પહોંચી તેમની પાસેથી પ્રાપ્ત થવા યોગ્ય પોતાના

भीज उत्कृष्ट प्रयोगनने अर्थात् प्राम करवा योऽथ वस्तुने ज्ञानुतो ने  
आम करतो हेवा छताये ने पोते ज्ञानौ थनारे। अने भरणुधर्मा छे  
अर्थात् ज्ञानरण्यशील छे एवा क्वचःस्थ छोईने पणु आ प्रमाणे  
अविवेकी माणुसो ॥ जे भेदनी मागणी करे एवां पुन्, धन अने  
सुवण्णौ वजेरे अस्थिर अनित्य पदार्थोनी मागणी ते कुर्ह रीते करे ?  
अर्थात् एवा पदार्थोनी अलिलाखा तेओ उयारे य न राखे !

क्वचःस्थ 'कु' ऐट्के पृथ्वी, ते अंतरिक्ष वजेरे लेडानी  
अपेक्षाये अध-नीची ('हेवाने कीधे' 'क्वचः' क्वेवाव) छे, तेना  
पर ने रहे छे तेने क्वचःस्थ क्वेवामां आवे छे.

क्वाई स्थाये 'क्वचःस्थः' ने अहले 'बब तदास्थः' एवा पणु  
पाठ छे. आ पक्षमां अक्षरे आ प्रमाणु गोडववा ज्ञेयच्छे, जेम के  
पुन् वजेरेमां ज्ञेनी आस्था-आस्थिति अर्थात् तत्प्रतापूर्वक ग्रन्थिति  
खेय ते 'तदास्थ' छे. ने पुरुष तेमनाथो पणु उत्कृष्टतर अने आम  
न थहि शहे एवा पुरुषार्थोने भागवाने धृच्छुक खेय ते पुरुष तेवा  
पदार्थोगां आस्था राखनारे कुर्ह रीते हेई शहे ? अर्थात् तेमने  
असार माननारे डेई पणु पुरुष तेमने। अलिलाखी हेई शहे नहीं;  
डेम के बधा ॥ भाणुसो 'उत्तरोत्तर उन्नत ॥ थवा चाहे छे तेथा भने  
पुन्, धन वजेरेने। लेल देखाडी ललचावी शकाय तेम नथा; वर्णी  
वंशौ प्रत्येनी आसक्तिथी प्राम थनारां आप्सरा वजेरे सुगोनी अस्थिर  
रूपमां लावना करतो, तेमने भिथ्या समजनारे क्यो विवेका पुरुष लांणुं  
आसुष्य मेणवी दीर्घ कागी सुधी ज्ञववामां आनंद मानरो ? अर्थात्  
एवी रीते लांणा समय सुधी ज्ञववामां डेईपणु पुरुष आनंद  
नहीं माने, ऐटला भाटे भने आ भिथ्या भोगेथी ललचाववानुं छोडी  
६४ मेरे ने वर मेणववा भाटे आपने आर्थना करी छे अने-२८  
यस्मिन्निदं विचिकित्सन्ति मृत्यौ यत्साम्पराप्ये महति ब्रूहि नस्तत् ।  
योऽयं वरो गूढमनुप्रविष्टो नान्यं तस्माच्चिकेता वृणीते ॥२९॥

મૃત્યો=હે યમરાજ, યસ્મિન् મહતિ સામ્પરાયે=ને મહાન આશ્ર્ય-  
મય પરલોક સંખાંધી આત્મગ્યાનના વિષયમાં, ઇદમ् વિચિકિત્સન્તિ=  
( માણુસો ) એવી શાંકા કરે છે કે મરણું પામ્યા પછી આ આત્મા  
રહે છે કે નહીં; ( તત્ત્વ ) યત્=એ વિષે ને નિષ્ઠુંય હોય, તત્ત્વનઃ બ્રૂહિ=  
તે આપ અમને કહેઓ; યઃ અયમ्=ને આ, ગૂદમ् અનુપ્રવિષ્ટઃ વરઃ=  
અત્યંત ગંભીરતાને પ્રાપું થયેલ ને વરદાન છે, તસ્માત्=તેનાથી,  
અન્યમ्=ખીજું વરદાન, નવિકેતા=નચિકેતા, ન વૃણીતે=માગતો નથી. ૨૬

નચિકેતા કહે છે કે, ‘હે યમરાજ ! જે આત્મતત્ત્વ  
સંખાંધી મહાન શાનના વિષયમાં લોકે। એવી શાંકા કરે  
છે કે, મરણું પછી આત્માનું અસ્તિત્વ રહે છે કે નહિ;  
એ વિષે આપનું જે નિષ્ઠુંયાત્મક અનુભૂત શાન હોય  
તેનો જ ઉપદેશ કૃપા કરીને મને કરો. આત્મતત્ત્વ  
સંખાંધી આ વર અત્યંત ગંભીર છે એ વાત સાચી છે;  
પરંતુ આપનો શિષ્ય આ નચિકેતા એનાથી બિજ  
ઝીંલો કેાઈ પણ વર મેળવવા દુઃખતો નથી. ( માટે  
આપવો હોય તો એ જ વર આપો. ’) ૨૬

માણ્ય : હે મૃત્યો ! પરલોકમાં સિધાવેલા ને જીવના વિષયમાં  
એવો સહેલ રાખવામાં આવે છે કે, મરણું પછી ‘તેનું અસ્તિત્વ રહે  
છે કે નહીં’ તે મહાન-મહાન પ્રયોગનના નિમિત્તભૂત સામ્પરાય—  
પરલોકના વિષયમાં તે આત્મા સંખાંધી જે નિશ્ચિત વિશાન છે તે  
અમને કહો. વધુ તો શું, આ જે આત્મવિષયક વર છે તે અત્યંત  
ગંભીર છે ને તેનું વર્ણન કે વિવેચન કરી શકાય નહીં એવી સ્થિતિને  
તે પામતો જ્ઞય છે. અવિવેકી માણુસો હોય તેઓ જ એનાથી બિજ  
વર માગો; પરંતુ નચિકેતા એ વરથી દૂસર અનિત્ય વસ્તુવિષયક વર  
મનથી પણ માગવાને દુઃખતો નથી—આ શ્રુતિનું વચ્ચન છે. ૨૬

શ્રીમતપરમહંસ પરિમાજકાચાર્ય કાગવાન શ્રીશંકરાચાર્ય રવેલા  
કડોપનિધના પ્રથમ અધ્યાયમાં પ્રથમ વહીજાય સમાપ્ત

## ભીજુ વહી

### શ્રેય-પ્રેયવિવેક

માણ્ય : એ પ્રમાણે શિષ્યની પરીક્ષા કરીને તેમ જ તેનામાં  
વિદ્યાઅહુણું કરવાની ચોઝ્યતા જણ્યા પછી યમરાને કહ્યું :  
અન્યજ્ઞેયોऽન્યદુતૈવ પ્રેયसો ઉમે નાનાથે પુરુષः સિનીતઃ ।  
તયોः શ્રેય આદદાનસ્ય સાધુર્મબતિ હીયતેર્થાદિ ઉ પ્રેયો વૃણીતે ॥

શ્રેયઃ=કલ્યાણું સાધન, અન્યત્ત=ખીજું ( જુદું ) છે, ઉત=અને  
પ્રેયઃ=પ્રિય લાગનારા બોગોનું સાધન, અન્યત્ત એવ=ખીજું ( જુદું ) જ  
છે, તે=તે, નાનાથે=જુદાં જુદાં ક્રણ આપનારાં. ઉમે=ખને સાધનો,  
પુરુષમ्=માણુસને, સિનીતઃ=ખાંધે છે—પોતપોતાના તરફ આકષે<sup>०</sup> છે,  
તયોઃ=તે ખનેમાંથી, શ્રેયઃ=કલ્યાણના સાધનને, આદદાનસ્ય=અહુણું કર-  
નારનું, સાધુઃ ભવતિ=કલ્યાણ થાય છે. ઉ યઃ=પણ જે, પ્રેય: વૃણીતે =  
સાંસારિક ઉત્તીતિનાં સાધનનો સ્વીકાર કરે છે, ( સઃ=તે, ) અર્થત્ત=  
ધર્થાર્થ લાલથી, હીયતે=બ્રહ્મ થઈ જાય છે. ૧

શ્રેય (વિદ્યા) જુદું છે ને પ્રેય(અવિદ્યા) પણ અલગ  
જ છે. લિઙ્ગલિઙ્ગ ક્રણ આપનારાં હોવા છતાં આ ખને  
સાધનો મનુષ્યને ખાંધે છે—તેને પોતાના તરફ આકષે<sup>૦</sup> છે.  
એ ખનેમાંથી શ્રેયને અહુણું કરનારનું કલ્યાણ થાય છે; પરંતુ જે  
પ્રેયને અપનાવે છે તે વાસ્તવિક સુખથી પરિત થઈ જાય છે. ૧

માણ્ય : શ્રેય અર્થત્ત નિઃશ્રેયસ જુદું છે ને વળી પ્રેય એટલે  
પ્રિયતર વસ્તુ પણ જુદી જ છે. એ શ્રેય અને પ્રેય ખને પ્રગોજન-  
વાળાં હોવા છતાંય અધિકારી અર્થત્ત વર્ણાશ્રમાદિ વિશિષ્ટ પુરુષને

બંધનમાં નાખ્યા હે છે, એટલે બધા માણુસો તેમના વડે જ પોતાના (વિદ્યા-અવિદ્યા સંબંધી) કર્તાદ્વથી સુકૃત થઈ જાય છે. અજ્ઞાદ્વયની ઘંચાવાળો પુરુષ પ્રેરથી અને અમૃતત્વનો અભિલાષી શ્રેષ્ઠી પ્રવૃત્ત થાય છે; તેથી શ્રેય અને પ્રેર આ બંનેનાં પ્રયોજનોની કર્તાદ્વત્તાને લીધે બધા માણુસો તેમનાથી બંધાયેલા હોવાનું કહેવાય છે. જોકે તેઓ દરેક પુરુષાર્થ સાથે સંબંધ રાખનારાં છે તો પણ વિદ્યા અને અવિદ્યારૂપ હોવાને લીધી પરસ્પર મિરૂદ્ધ છે. તેથી તેમાંના ગમે તે એકનો ત્યાગ કર્યા સિવાય એક માણુસથી તે બંનેનું એકસાથે જ અનુઝ્ઞાન અર્થાત્ પાલન થઈ શકતું નથી. મારે તેમાંના અવિદ્યારૂપ પ્રેરનો ત્યાગ કરી ડ્રેવળ શ્રેયનો જ સ્વીકાર કરનારાનું સાધુ—શુભ અર્થાત્ કહાણું થાય છે. જે ગુંડે દૂરદર્શી નથી તે આ અર્થ—પુરુષાર્થ અર્થાત્ પરમાર્થ સંબંધી નિત્ય પ્રયોજનથી ચ્યુત થઈ જાય છે; ઢાણું છે તે ? તે એ જ છે કે જે પ્રેરને અપનાવે છે—એની માણણી કરે છે; આ એનું તાત્પર્ય છે. ૧

શ્રેયશ્વ ગ્રેગશ્વ મનુષ્યમેતસ્તૌ સમ્પરીત્ય વિવિનક્તિ ધીરઃ ।  
શ્રેયો હિ ધીરોऽભિ પ્રેરસો વૃણીતે પ્રેરો મન્દો યોગક્ષેમાદ્ વૃણીતે ॥

શ્રેય: ચ=પ્રેરઃ ચ=શ્રેય અને પ્રેર—આ બંને જ, મનુષ્યમ् એતઃ—મનુષ્યની આગળી આવે છે; ધીરઃ=બુદ્ધિમાન માણુસ, તૌ=એ બંનેના સ્વરૂપ પર; સમ્પરીત્ય=સારી એક વિસાર કરતાને, વિવિનક્તિ=તેમને જુદાં જુદાં સાગળું સે છે; ( અને ) ધીરઃ=તે શ્રેષ્ઠ બુદ્ધિવાળો માણુસ, શ્રેય: હિ=પરમકલ્યાણના સાધનને જ, પ્રેરસઃ=પ્રેર ( ભાગ—સાધન ) કરતાં અભિવૃણીતે=શ્રેષ્ઠ માનીને પ્રફંડું કરે છે; ( પરંતુ ), મન્દઃ=મંદબુદ્ધિવાળો માણુસ, યોગક્ષેમાનું=લોકિક યોગક્ષેમની કામનાથી, પ્રેરઃ વૃણીતે=લોગેના સાધનરૂપ પ્રેરને અપનાવે છે. ૨

શ્રેય અને પ્રેર ( અને લગભગ એકષિણ સાથે મળીને ) માણુસની પાસે આવે છે. બુદ્ધિમાન માણુસ સારી

એડ વિચાર કરીને તે બનેને એકખીજાથી જુદાં કરે છે. વિવેકી પુરુષ પ્રેયથી શ્રેયને શ્રેષ્ઠ માનીને તેને જ અપનાવે છે; પરંતુ મૂર્ખ—અરૂપાની માણુસ યોગદ્દેમના નિમિત્તથી પ્રેયને અપનાવે છે. ૨

**ભાષ્ય :** એવ તથા પ્રેય આ બંનેનો સ્વીકાર કરવાનું મનુષ્યને અધીન છે, તો પછી માણુસો ખાસ કરીને પ્રેયનો જ સ્વીકાર શા માટે કરે છે તે વિષે કહે છે : એ બંનેનો સ્વીકાર કરવો મનુષ્યને અધીન છે એ વાત ખરી છે; તોપણું તે શ્રેય અને પ્રેય મંહૃદ્ભિ માણુસો માટે સાધન અને ફળની દર્શિથી નેમને જુદા કરવાનું હામ ઘણું કહીન છે એવાં થઈ બંને લગભગ એકખીજ સાથે મળીને જ મનુષ્ય અર્થાત જીવને પ્રાતિ થાય છે; એટલા માટે હંસ જેવી રીતે પાણીથી દૂધને જુદું કરી લે છે તેવી જ રીત ધીર-ધૂદ્ધિમાન પુરુષ તે શ્રેય અને પ્રેય પદાર્થોની મનથી સારી રીતે આદેશના કરી, તેમના ગૌરવ અને લાઘવનો વિવેક અર્થાત પૃથ્રારણું કરે છે. આ રીતે શ્રેયને પ્રેથમથી જુદું પાડી તેમ જ પ્રેય કરતાં શ્રેય વધુ અલીષ્ટ હોવાથી શ્રેયને જ અહેણું કરે છે; પરંતુ એવી રીતે કરે છે હોણું ? તે જ કે જુદ્ધિમાન છે.

આથી વિપરીત મંદ અર્થાત અદ્ય જુદ્ધિવાળા માણુસ તેનામાં વિવેકશક્તિનો અભાવ હોવાને લાઘે ડેવળ યોગદ્દેમના કારણરૂપ અર્થાત ને શરીરાદિની વૃદ્ધિ અને રક્ષાનું જ નિમિત્ત જ છે એવા પશુ-પુત્રાદ્ધિરૂપ પ્રેયને જ અપનાવે છે. ૨

સ ત્વं પ્રિયાન્પ્રિયરૂપા ઽશ્ર કામાનભિધ્યાયનચિકેતો ઽત્યસ્તાક્ષીઃ ।  
નૈતાઽસુઙ્કાં વિત્તમયીમવાસો યર્સ્યાં મજ્જન્તિ વહવો મનુષ્યાઃ ॥૩॥

નચ્ચિકેતો=હે નચ્ચિદેતા ! ( એ માણુસોમાં ), સ: તમ્=તમે ( એવા નિઃસ્પૂહ છોડે ), પ્રિયાન् ચ=પ્રિય લાગનાર અને, પ્રિયરૂપાન्=અત્યંત સુદૂર રૂપવાળા, કામાન्=આ લોક અને પરલોકના સધળા લોગોને,

અમિત્યાવન्=સારી પેટે વિચાર કરીને, અલ્યસાક્ષીઃ=તમે છોડી દીધા, એતામ् વિત્તમયોમ् સક્ષમામ्-આ સંપત્તિરૂપ સાંકળ( બેડી )ને, ન અવાસઃ= (તમે) પ્રાપું થયા નહીં ( એના બંધનમાં ન ફસ્યા ), યસ્યામુ=જેમાં, બહુવः મનુષ્યાઃ=ધર્ણાખરા માણુસો, મજન્તિ=ઇસાઈ જાય છે. ૩

હે નચિકેતા ! પુત્ર, સંપત્તિ-ધન વગેરે પ્રિય અને અપ્સરા વગેરે પ્રિયરૂપ લોગોને, તેઓ અસાર છે એમ તોં સમજુને ત્યલુ દીધા છે અને જેમાં ધર્ણા માણુસો દુધી જાય છે તે આ ધનરૂપ નિંદિત ગતિને તું પાપ થયો. નહિ અર્થાત્ તું એમાં ઇસાયો નથી. ૩

**ભાષ્ય :** હે નચિકેતા ! મેં તને અનેક પ્રકારનાં પ્રલોભનો આધ્યાં તોપણું પુત્ર વગેરે પ્રિય તથા અસરા વગેરે પ્રિયરૂપ લોગોને અસાર અને અનિત્ય જણુને તોં તેમનો પરિત્યાગ કરી દીધો એવી તારી ખુદ્ધિમત્તાને ધન્ય છે. મૂઢ અને અશાની પુરુષો જ જેમાં પ્રવૃત્ત થતા હોય છે તે વિત્તમયો-સમ્પત્તિયુક્ત નિંદિત ગતિને તું પ્રાપું થયો. નથી. એ માર્ગમાં ધર્ણા મૂઢ પુરુષો ઇસાઈ જાય છે અર્થાત્ દુઃખ લોગવે છે. ૩

‘તેમાંના શ્રેયતું ભરુણુ કરનારા માણુસનું કલ્યાણ થાય છે ને જે પ્રેયને અપનાવે છે તે પુરુષાર્થી પતિત થઈ જાય છે’ એમ જે ઉપર ( આ વહીના પ્રથમ મંત્રમાં ) કહેવામાં આવ્યુ છે તેનું શું પ્રયોજન છે ? શાથી તેમ કહેવામાં આવ્યું છે ? ( એ વિષે યમરાજ કહે છે, ) કારણ કે-

દૂરમેતે વિપરીતે વિપૂચી અવિદ્યા યા ચ વિદ્યેતિ જ્ઞાતા ।  
વિદ્યામીષિનં નચિકેતસં મન્યે ન ત્વા કામા બહુવોદ્લોલુપન્ત ॥

યા અવિદ્યા=જે અવિદ્યા, ચ વિદ્યા ઇતિ જ્ઞાતા=અને વિદ્યાના નામથી પ્રસિદ્ધ છે, એતે=આ બંને, દૂરમું વિપરીતે=પરસ્પર અત્યંત વિપરીત ( અને ), વિપૂચી=લિંગ લિંગ ઇણ આપનારી છે, નચિકેતસમ= (તમને) નચિકેતાને, વિદ્યામીષિનં મન્યે=હું વિદ્યાનો જ અલિલાભી

માનું છું, (કેમ કે), લા વહુઃ કામાઃ=તમને ઘણા બધા ભોગો, ન અજોલુપન્ત =કોઈ રીતે પણ લલચાવી શક્યા નહીં. ૪

જે વિદ્યા અને અવિદ્યારૂપથી જાણુવામાં આવેલી છે તે ખણે અત્યારે વિરુદ્ધ સ્વલ્પાવવાળી અને વિપરીત ઈણ આપનારી છે. હું નચિકેતાને (તમને) વિદ્યાનો અભિલાષી માનું છું કેમકે તમને અનેક પ્રકારના ભોગો (કોઈ પણ રીતે) લલચાવી શક્યા નહીં. ૪

**માણય :** આ બંને અક્ષાંશ અને અંધકારની પેઢે વિવેક અને અવિવેકરૂપ હોવાથી ‘દૂરમ्’ અર્થાતું એ બે વર્ગે મહાન અંતર હોવા સાથે એકખીજથી વિપરીત છે-પરસ્પર એકખીજથી વીટળાયેલાં છે; વળી વિષુચી અર્થાતું વિનિધિ અક્ષારની ગતિવાળાં એટલે કે એ બંને તરવેા સંસાર અને મોક્ષના હેતુરૂપ હોવાથી જુદા જુદા પ્રકારના ઝણથી યુક્ત છે. એવાં એ તરવેા ઠથાં છે ? એ વિષે કહે છે કે, પંડિતો વડે શ્રેયને વિષય કરનારી અવિદ્યા તથા શ્રેયને વિષય કરનારી વિદ્યારૂપથી તે તરવેા જાણુવામાં આવે છે. તે બંનેમાં તને નચિકેતાને હું વિદ્યાનો અભિલાષી અર્થાતું વિદ્યાનો અર્થી ‘માનું છું’. શાથી એમ માનું છું ? એનું કારણ એ છે કે, અવિવેકાશોની ખુલ્લિને લોલાવનારા અપ્સરા વગેરે અનેક પ્રકારના ભોગો પણ તને લોલાવી શક્યા નહીં—તેમણે તારા હૃદયમાં પોતાને ભોગવાની ઉંચળા ઉત્પત્તિ કરીને તને શ્રેયના માર્ગથી વિચલિત કર્યો નહીં; એટલા માટે હું તને વિદ્યાનો અર્થી એટલે શ્રેયનો અધિકારી માનું છું—આ એનો આશય છે. ૪

### અવિદ્યામાં ઇસાયેલાયોની દુર્શા

પરંતુ જેઓ સંસારના અધિકારી છે—

અવિદ્યાયામતરે વર્તમાનાઃ સ્વયં ધીરાઃ પણ્ડિતંમન્યમાનાઃ ।  
દન્દ્રમ્યમાણાઃ પરિયન્તિ મૂढા અન્ધેનૈવ નીયમાના યથાન્ધાઃ ॥૫

अविद्यायामन्तरे वर्तमानाः=अविद्याभां रहेवा छतांय, स्वयं धीराः=पोतानी ज्ञाने भुद्धिमान् ( अने ), पण्डितम् मन्यमानाः=विद्वान् भान्तनारा, मूढाः=( लोगने छच्छन्नारा ) ते भूर्ख माणुसो, दन्द्रम्यमाणाः=विविध योनिभोभां यारे चारे बालु लटक्या करी, ( तथा ) परियन्ति=बरापर तेवी जै रीते अथडाता रहे छे, यथा=जेवी रीते, अन्धेन एव नीयमानाः=आंधणा वडे होराता, अन्धाः=आंधणाच्चो। पोताना छू रुथो न पहेंचतां आमतेम लटकता-अथडाता कृष पामे छे. ५

ते अविद्याभां रहेतारा, पोतानी ज्ञाते जै महान् भुद्धि-शाली अनी बेठेला ने पोताने पंडित भान्तनारा भूर्ख-माणुसो आंधणा वडे होराता आंधणा माणुसनी बेडे अनेक कुटिल गतिओनी छूछा करता रहीने लटकता इरे छे. ५

**आङ्ग:** तेओ गाढ आंधकार जेवी अविद्याभां इसाचेला रही पुन-पशु वगेरे अनेक तृष्णाहृपी जग्भां णंधाईने व्यवहारभां लागेला रहे छे. जेवी रीते आंधणा भाणुस वडे होराई विषम भार्गभां लाई जैवाता धण्णा आंधणाच्चो। भहानं अनर्थ्ने आस थाय छे; अर्थात् लारे भुद्धेलीभां मुकाई ज्य छे तेवी जै रीते ' अमे भोटा धीर अटले भुद्धिमान् छीओ ने पंडित अर्थात् शास्त्रोभां कुशां छीओ ' आ प्रभाष्ये पोतानी ज्ञाने भान्तनारा ते भूढ-अविवेकी पुरुषो नाना अकारनी अत्यंत कुटिल गतिओनी छूछा करता रही जरा, भरण अने रोग वगेरे दुःखोयो पिडाईने आमतेम लटकता इरे छे. ५  
अटला भाटे भूढताने लीघे-

न साम्यरायः प्रतिभाति बालं प्रमाद्यन्तं वित्तमोहेन मूढम् ।  
अर्थं लोको नास्ति पर इति मानी पुनः पुनर्वशमापद्यते मे ॥६॥

वित्तमोहेन मूढम्=आ प्रभाष्ये संपत्तिना भोहथी भूढ बनेलाने, प्रमाद्यन्तम् बालम्=हुमेशां प्रभाद करनारा अस्तानीने, साम्यरायः=परलोक, न प्रतिभाति=सूजतो नथी, अयम् लोकः=( ते अम समजे छे के ) आ

પ્રલ્યક્ષ દેખાતો લોક જ સાથે છે, પરઃ ન અસ્તિ=એના સિવાય બીજુ (સ્વર્ગ—નરક વગેરે) કાંઈ પણ નથી, ઇતિ માની=આ પ્રમાણે માનનારો અલિમાની માણુસ, પુનઃ પુનઃ=વારંવાર, મે કદમ્ભ=મારા (યંમરાવજના) તાણામાં, આપણાતે=આવે છે. ૬

ધનના મોહથી અંધ બનેલા ને પ્રમાણી તે મૂર્ખ માણુસને પરલોકનું સાધન સુઅર્તું નથી. આ લોક છે, પરલોક નથી, એમ માનનારો માણુસ વારંવાર મારા વશમાં આવે છે. ૬

**ભાષ્ય :** તેને પરલોકનો જ્યાલ જ આવતો નથી. ભરણું પછી જેના અતિ ગમન કરવામાં આવે છે તેને સામ્પરાય—પરલોક કહેવામાં આવે છે. તેની પ્રાપ્તિ જેનું પ્રયોજન છે તે સાધનવિશેષ શાસ્ત્રોચ્ચ સામ્પરાય છે. તે જાળ અર્થાત્ અવિવેકી પુરુષની સમક્ષ પ્રકાશિત થતું નથી; અર્થાત્ તેના ચિત્ત જાળની તે ઉપસ્થિત થતું નથી. તેવી જ રીતે જે પ્રમાણ કરનારો છે—જેનું ચિત્ત પુત્ર—પણ વગેરે પ્રયોજનોમાં જ આસક્ત છે ને ને ધનના મોહથી અર્થાત્ ધનનિભિતના અવિવેકથી મૂઢ છે. અર્થાત્ અરૂણનથી ધેરાયેલો છે (તે મૂઢને પરલોકનું સાધન સુઅર્તું નથી.) ‘આ જે સ્વી અને અજ—પાનાદિ વિશિષ્ટ દેખાતો લોક છે બસ તે જ છે, એનાથી બીજો ડોઈ (સ્વર્ગાદિ) લોક નથી.’ આ પ્રમાણે માનનારો માણુસ વારંવાર જ-મ લઈ મારે (મૃત્યુને) તાણે થાય છે; અર્થાત્ તે જ-મ—મરણુરૂપ હુઃઅ-પરંપરા પર આરૂપ થયેલો હોય છે. ધણું કરીને આ લોક આવા જ પ્રકારનો છે. ૬

### આત્મજ્ઞાનની દુલ્લભતા

શ્રવણાયાપિ બહુમિયોન લભ્યઃ શૃષ્ટાન્તોऽપિ બહવો યં ન વિદ્યુઃ ।  
આશ્રયોચ્ચ વક્તા કુરુલોઽસ્ય લભ્યાશ્રયોજ્ઞાતા કુરુલાનુશિષ્ટઃ ॥૭॥

યઃ બહુમિઃ=જે (આત્મતત્ત્વ) ધણું એને તો, શ્રવણાય અપિ= સાંસ-ગ્રામા માટે પણ, ન લભ્યઃ=મળતું નથી, યમ્ભ=જેને, બહવઃ=ધણું માણુસો,

શુદ્ધન્તः અધિ=સાંભળાને પણ, ન વિદ્યુઃ=સમજ શક્તા નથી, અસ્ય=એવા આ ગૂઢ આત્મતત્ત્વનું, બત્તા આશ્ર્વયঃ=વર્ણન કરનારો મહાપુરુષ આશ્ર્વયોભ્ય છે ( ધણો હુલ્લાં છે ), લંઘા કુશાલઃ=તેને પ્રાપ્ત કરનારું પણ અતિ કુશળ ( સદ્ગુણ જીવન ) ડેઈક જ હોય છે, કુશાલાનુશિષ્ટઃ=ને નેને તત્ત્વની પ્રાપ્તિ થઈ ગઈ છે એવા શાની મહાપુરુષ વડે શિક્ષણ પામેલો, જ્ઞાતા=આત્મતત્ત્વને જ્ઞાણનારો પણ, આશ્ર્વયঃ=આશ્ર્વયોભ્ય છે ( અત્યંત હુલ્લાં છે ). ૭

જે ( આત્મા ) ધણુઓને તો સાંભળવા માટે પણ મળતો નથી, જેને વિધે અનેકો સાંભળ્યા પછી તેને સમજતા નથી કે સમજ શક્તા નથી તે આત્મતત્ત્વનું નિરૂપણ કરનારો પણ આશ્ર્વયોઽપ છે અર્થાતું ધણો હુલ્લાં છે, તેને પ્રાપ્ત કરનારો પણ ડેઈ નિપુણ પુરુષ જ હોય છે; તેમ જ કુશળ આચાર્ય વડે ઉપદેશ કરાયેલો તેને જ્ઞાણનારો પણ આશ્ર્વયોઽપ એટલે અત્યંત હુલ્લાં છે. ૭

**ભાષ્ય :** જે આત્મા ધણુઓને તો સાંભળવા પણ મળતો નથી; ને ખીંચ ધણુા અભાગી, અશુદ્ધચિત્ત માણસો જે આત્મતત્ત્વને સાંભળાને પણ જ્ઞાણી શકતા નથી; એટલું જ નહિ, એનો વક્તા પણ આશ્ર્વયોઽપ અર્થાતું અદ્ભુત જેવો જ છે-તે પણ ધણુઓમાંથી ડેઈક જ હોય છે. વળો સાંભળ્યા પછી પણ આ આત્માને પ્રહુણ કરનારો તો અનેકામાં ડેઈ નિપુણ પુરુષ જ હોય છે, ડેમ કે ( આત્મદર્શનમાં ) કુશળ આચાર્ય જેને ઉપદેશ કર્યો હોય એવો એનો જ્ઞાતા પણ આશ્ર્વયોઽપ જ છે. ૭

ડેમ કે-

ન નરેણાવરેણ પ્રોક્ત એવ સુવિજ્ઞેયો બહુધા ચિન્ત્યમાનઃ ।  
અનન્યપ્રોક્તે ગતિસ્ત્ર નાસ્તિ અણીયાન્યતકર્મમણુપ્રમાણાત् ॥૮॥

અવરેણ નરેણ પ્રોક્તঃ=અદ્વિતીય મતુષ્ય વડે કહેવાયાથી, બહુધા

चिन्त्यमानः=( ने ते प्रभाणे ) धण्डी रीते चिंतन कर्ता छतां पण्, एवः=आ आत्मतत्त्व, सुविज्ञेयः न=सहेजे समज्ञय तेवुं नथी, अनन्य-प्रोक्ते=केहि खीज जानी पुरुष वडे उपदेश न करवामां आवे तो, अत्र गतिः न अस्ति=या। विषयमां मनुष्यनो प्रवेश थतो नथी, हि अणुप्रमाणात्=केम के आ अत्यंत सूक्ष्म वस्तु करतां पण्, अणीयान्=वधु सूक्ष्म छे, अतर्कर्त्यम्=( ऐटला माटे ) तक्थी अतीत छे अर्थात् ऐना। विषे तक्थी पण् करी शकातो नथी. ८

अनेक रीते चिंतन करायेदो आ आत्मा अहपश मनुष्य वडे जणुवातां सारी रीते समज्ञ शकाय तेवो नथी। अबोददशी० केहि खीज जानी पुरुष आ आत्मतत्त्व विषे उपदेश न करे तो आ विषयमां मनुष्यनो प्रवेश थतो नथी केमके अत्यंत सूक्ष्म वस्तु करतां पण् वधु सूक्ष्म छे ने अताक्थ० हेवाथी हुविंश्चेय पण् छे. ८

भाष्य : आ आत्मा, जेने विषे तमे मने पूछी रखा छो ते केहि अपर-हीन अर्थात् अहपशुद्धि मनुष्यना कहेवाथी सारी रीते जाण्डी शकाय तेवो नथी; कारणु के वाढीओ। अस्ति-नास्ति ( छे-नथी ) कर्ता—अकर्ता तेम जै शुद्ध—अशुद्ध आ प्रगाणे अनेक रीते ओ आत्मातुं चिंतन करता होय छे.

वारु, तो पछी ओ ( आत्मा ) कहि रीते जाण्डी शकाय छे ? ओ विषे कहे छे : अनन्यप्रोक्ता-अनन्य अर्थात् पोताना प्रतिपाद्य अगस्त्वरूपने प्राप्त थयेला अपृथक्दशी० ऐटले अबोद द्विष्वागा आयार्य० ना कहेवाथी आ आत्मामां अस्ति-नास्तिरूप गति ऐटले चिंता नथी; कारणु के आत्मा सर्व विकल्पोनी गतिथी रहित छे.

अथवा अनन्यप्रोक्ता-पोताना स्वरूपभूत अनन्य आत्मा विषे गुरु वडे उपदेश करवामां आवतां अन्य शेय वस्तुनो अखाव थवाने लाधे तेमां केहि गति अर्थात् खीज केहि अवगति ( शान )

રહેતી નથી; કારણ કે આત્માના એકત્વનું વિશાળ જ જીનની પરાનિષ્ઠા છે, એટલે જૈવ વસ્તુનો અભાવ થયા પછી અન્ય કોઈ ગતિ અહીં બાકી રહેતી નથી; અથવા તે અન્ય અર્થાતું સ્વાત્મજ્ઞતા આત્મતત્ત્વનો ઉપરોક્ત અપાવા પછી સંસારની ગતિ રહેતી નથી; કારણ કે તે પછી તરત જ આત્મવિશાળના ફળરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે.

અથવા હુએ પછી કંઈ વળુંન કરવામાં આવશે તે અભિન્નજ્ઞતા આચાર્યે<sup>८</sup> ઉપરોક્ત કરેલા આ આત્મતત્ત્વમાં અગતિ-અનવિષેધ અર્થાતું અપરિશાન રહેતું નથી; એટલે આચાર્યની પેઢે તે ઓતાને પણ  
‘તે ( અન ) હું છું.’ આ આત્મવિષયક જીન થઈ જ જય છે.

આ ગ્રામાણ્ણે શાસ્ત્રનો જણનારા આચાર્યે<sup>૯</sup> અલિન્દપથી કહેલો આત્મા સારી પેડે જ્ઞાની રાકાય છે, એમ ન થાય તો આ આણું જૈવદી વસ્તુ કરતાં પણ આણું થઈ જય છે; પાતાની ખુદ્ધિના ડેવળ તર્ક વડે એનું જીન થઈ શકતું નથી. વળી જો કોઈ પુરુષ તર્ક વડે તે આણું જૈવડા આત્માને સથાપિત કરે તો પણ ખીને કોઈ તેના કરતાં પણ આણુંતર ને વળી વીજે તેના કરતાંથી અત્યંત આણું અર્થાતું આણુંતમ આત્મા સથાપિત કરી દેશે; કારણ કે કુત્કાર્ય કુયાંય આટકતો નથી. ૮

નैષા તકેણ મતિરાપનેયા પ્રોક્તાન્યેનૈવ સુજ્ઞાનાય પ્રેષુ ।  
યાં ત્વમાપઃ સત્યઘૃતિર્વતાસિ ત્વાદ્બુનો ભૂયાનચિકેતઃ પ્રષ્ટા ॥

પ્રેષુ-હે જિયતમ ! યામ् ત્વમ् આપઃ=જે તમે પામ્યા છો, એષા મતિ:= (તે) આ ખુદ્ધિ, તકેણ ન આપનેયા=તર્કથી મળી શકતી નથી. (આ તો), અન્યેન પ્રોક્તા એવ=ખીંજ વડે કહેવાયેલી જ, સુજ્ઞાનાય=આત્મવિશાળાનાં નિમિત, (મતિ)=થાવ છે. વત=ખરેખર, (તમે) સત્યઘૃતિ:= ઉત્તામ ધૈર્યવાન, અણિ=છો, નચિકેતઃ હે નચિકેતા ! (અમે ખુદ્ધીઓ છીએ કે), ત્વાદ્બુનુ=તમારા જોવો જ. પ્રષ્ટા=પૂછનારો, ન: ભૂયાત્=અમને

मध्या ५२. ६

हे वत्स ! सभ्यकु ज्ञान माटे शुण तार्किं क आचार्यथी  
जिज्ञ अवा शास्त्रना जाणुनारा आचार्ये क्षेली आ अुद्धि  
ज्ञेने तमे पाच्या छो ले तार्किं भजी शक्ती नथी.  
अदेखर ! तमे उत्तम धैर्यवाणा छो. हे नियिकेता ! अमने  
तमारा ज्ञेवो ज्ञ प्रश्न पूछनारो भज्या उरे. ६

**भाष्य :** एटला माटे अबोद्दर्शी आचार्ये उपदेशेला आत्मागां  
उपभ थेली जे आ शास्त्रागतिपाद आत्मविषयक भति छे ते वितर्क  
मात्रथी आम यवा योज्य नथी; अथवा ( अम समन्वे ) आ  
आत्मगुद्धि तर्कशक्तिथी त्याग करना योज्य नथी; कारणु के तार्किं  
तो आध्यात्मशास्त्रथी अन्नाणु लेख छे. ते प्रातानी उद्धिनी कृपना  
करी भन झावे ते बोल्या करे छे; तेथी हे प्रेष-वत्सतम ! आ ज्ञे  
शास्त्राग्नित आत्मगुद्धि छे ते तो तार्किंकथा, लग डाई शास्त्र  
ज्ञानुनारा आचार्य उपदेश करे तो ज्ञ ते सम्यक्षानुं कारणु ज्ञने छे.

मीड, तो पठी तर्किं न भजी शके ओवी भति कर्त छे ? ते  
विरो छेहे छे : ज्ञ भतिने तो भारा वरङ्घानथी प्राप्त करी छे, ते  
तारी धृति सत्य अर्थात् यथार्थ पदार्थाने विषय करनारी छे माटे  
हुं सत्यधृति छे. ‘कत’ आ अव्ययथी ह्या करता यमराज हुवे  
पठी क्लेवामां आवनारा विसाननी स्तुति माटे नियिकेताने कहे छे :  
‘हे नियिकेता ! अमने तारा ज्ञेवा प्रश्न करनारो खीजे पुन अथवा  
शिष्य भणे; परंतु ते पाणु तारा ज्ञेवा ज्ञ भणे.’ ६

### कर्मकृणनी अनित्यता

जानाम्यहं शेवधिरित्यनित्यं न ह्यध्रुवैः प्राप्यते हि ध्रुवं तत् ।  
ततो मया नाचिकेतश्चितोऽग्निरनित्यैर्द्वयैः प्राप्सवानस्मि नित्यम् ॥

अहं जानामि=हुं ज्ञानु खुं के, शेवधिः=कर्मकृणरूप निधि, अनित्यम्

ઇતિ=અનિત્ય છે, હિ અદ્વુવૈः=કારણુ કે અનિત્ય ( વિનાશરીલ ) વસ્તુ-  
એથી, તત् દ્વારમ્ભ=તે નિત્ય ( તત્ત્વ ) પરમાત્મા, ન હિ પ્રાપ્તા=મળી  
શકતો નથી, તત્=તેથી મયા=એટલે મારા વડે ( કર્તાબ્યબુદ્ધિથી ),  
અનિત્યૈઃ દ્વાર્યૈઃ=અનિત્ય પદાર્થોથી, નાચિકેતઃ=નાચિકેતા નામના, અદ્વિ:  
ચિતઃ=અદ્વિનું ચયન કરવામાં આવ્યું ( અનિત્ય ભોગોની પ્રાપ્તિ માટે  
નહિ, એથી તે નિષ્કામભાવના અપૂર્ણ શક્તિથી હું ), નિત્યમ્ભ=નિત્ય  
વસ્તુ પરમાત્માને, પ્રાપ્તવાન् અસ્મિ=પામ્યો છું. ૧૦

હું એ જાણું છું કે, કર્મદ્વારાનુભિંદિંધિ અનિત્ય છે.  
કારણુ કે અનિત્ય રાધનોથી તે નિત્ય ( આત્મા ) પ્રાપ્ત  
કરી શકતો નથી; એટલે મારા વડે નાચિકેત અદ્વિનું  
ચયન કરવામાં આવ્યું. તે અનિત્ય પદાર્થોથી જ હું  
( આપેક્ષિક ) નિત્ય ( યમરાજના સ્થાન )ને પામ્યો છું. ૧૦

**ભાષ્ય :** કેને માટે નિધિ ( ખજાના )ની ગ્રંથ પ્રાર્થના કરવામાં  
આવે છે તે કર્મદ્વારાનુભિંદિંધિ જ 'રોવધિ' છે. આ અનિત્ય છે  
એમ હું જાણું છું; વળી આ અનિત્ય અર્થાત્ અસ્થિર સાધનોથી  
તે પરમાત્મા નામનો નિત્ય-સ્થિર નિધિ મેળવી શકતો નથી; દ્વારા  
કે ને નિધિ અનિત્ય સુખસ્વરૂપ છે તે જ અનિત્ય પદાર્થોથી પ્રાપ્ત  
થાય છે. એટલા માટે 'અનિત્ય સાધનોથી નિત્યની પ્રાપ્તિ થતી નથી'  
એવું જાણ્યા છતાંથી મેં નાચિકેત અદ્વિનું ચયન કર્યું હજું; અર્થાત્  
પશુ વગેરે અનિત્ય પદાર્થોથી સ્વર्गસુખના સાધનસ્વરૂપ તે અદ્વિને  
મેળવ્યો હતો તેનાથી મેં અધિકાર મેળવીને આપેક્ષિક નિત્ય સ્વર્ગ  
નામના થામ્ય સ્થાનને મેળવ્યું છે. ૧૦

### નાચિકેતાના ત્યાગની પ્રશાસા

કામસ્યાસિ જગતઃ પ્રતિष્ઠાં ક્રતૌરનન્ત્યમભ્યસ્વ પારમ् ।  
સ્તોમમહુરુગાયં પ્રતિષ્ઠાં દૃષ્ટા ઘૃત્યા ધીરો નાચિકેતોઽત્યસ્ત્રાક્ષીઃ ॥

નચિકેતઃ=હે નચિકેતા, કામસ્ય આસિમને સર્વો પ્રકારના બોગોની અવધિ છે, જગતઃ પ્રતિષ્ઠામુંને જગતનો આધાર છે, બ્રહ્મો: અનન્તયમુંચિરસ્થાયી ઇળ છે, અમયસ્ય પારમુંનિલોચિતાની અવધિ છે, (અને) સ્તોમમહતું=સ્તુતિ કરવા યોગ્ય તેમ જ મહેતવપૂર્ણ છે (તથા), ઉદ્ગાયત્ર=વેહોમાં જેના ગુણો નાના પ્રકારથી ગાવામાં આવ્યા છે, પ્રતિષ્ઠામું=(અને) જે લાંબા સમય લુધી રહેનાર છે ઓવા સ્વર્ગલોકને દૃષ્ટવા ઘૃત્યા=જોઈને પણ તમે ધૈર્યપૂર્વક, અત્યલાખીઃ=તેનો ત્યાગ કરો, (અતઃ)=તેથી હું માતું હું કે, ધીરઃ (અસિ)=(તમે ઘણ્ણા જ) બુદ્ધિમાન છો. ૧૧

હે નચિકેતા ! તમે તો ઘણ્ણા જ બુદ્ધિમાન છો, બોગોની સમાસિ ( અવધિ ), જગતની પ્રતિષ્ઠા અર્થાતું જગતનો આધાર, ચશ્નું ચિરસ્થાયી ઇળ, નિલોચિતાની મૃદ્યાંદા તેમ જ સ્તુતિ કરવા યોગ્ય અને વેહોમાં જેના અનેક પ્રકારે ગુણગાન કરવામાં આવ્યાં છે ને જે ચિરસ્થાયી છે ઓવા અણિમાદિ ઔદ્ધ્યાથી ચુક્તા સ્વર્ગલોકને જોઈને પણ તમે ધૈર્યપૂર્વક તેનો ત્યાગ કરો ઓ કંઈ સાધારણું વાત નથી. ૧૧

**ભાસ્ય :** પરંતુ હે નચિકેતા ! તમે તો ધીર-ધૃતિમાન બનીને કામનાચોની આસિ-સમાસિને-દ્રોમ કે આ( હિરણ્યગંગાં પદ )માં જ સર્વો કામનાચો સમાસ થઈ જય છે તથા સર્વાત્મક હોવાને લાઘે અભ્યાત્મા, અધિભૂત ને અધિદેવરૂપ જગતની પ્રતિષ્ઠા અર્થાતું આશ્રયને, વશના અભૂત્ય-આનન્દ્ય ચોટથે અનંત ઇળ હિરણ્યગંગાં પદને, અલયની પાર અર્થાતું પરાનિશાનો અને સ્તોમ-સ્તુત્ય તેમ જ મહાન-અણિમાદિ ઔદ્ધ્ય વગેરે અનેક ગુણોના સમૂહથી યુક્તા, આ પ્રમાણે જે સ્તોમ છે ને મહાન પણ છે ઓમ સર્વોત્કૃષ્ટ હોવાને લાઘે સ્તોમ-મહતું ડરુગાય-વિસ્તીર્ણ ગતિને તથા પ્રતિષ્ઠા-પોતાની સર્વોત્તમ સ્થિતિ

ज्ञोनि पशु तेना धैर्यं पूर्वकं त्याग हयोः; अर्थात् उवले पर ओटले श्रेष्ठ वस्तुनी ज्ञ चूचता रहीने आ संपूर्णं संसारिकं ज्ञोग-समूहना परित्याग कर्मोः; खरेखर तमे उत्कृष्ट गुणोवाणा छ। ११

### वाऽभृत्याननु शृणु

तं दुर्दर्शं गूढमनुप्रविष्टं गुहाहितं गह्यरेष्टं पुराणम् ।  
अस्यात्मयोगाधिगमेन देवं मत्वा धीरो हर्षशोको जहाति ॥ १२

गूढम्=ज्ञोगभावाना पठामां शुपायेला, अनुप्रविष्टम्=सर्वोद्यापि, गुहाहितम्=सर्वना छृद्यरपि शुहामां रहेलो ( तेथी ) गह्यरेष्टम्=संसारङ्गम गहन वनमां रहेनारा, पुराणम्=सनातन ग्रेवा, तम् दुर्दर्शम् देवम्=लाभये ज्ञ ज्ञोवामां आवता ते परमात्म देवने, धीरः=शुद्ध शुद्धिथी शुक्ता साधक, अस्यात्मयोगाधिगमेन=आश्चात्मज्ञोगनी आभिष्ठि वड, मत्वा=मानीने, हर्षशोको जहाति=५५° अने शोकने छाडी हे छ। १२

ज्ञोगभावाना पठामां शुपायेला, सर्वोद्यापि, छृद्य-  
शृपि शुहामां रहेला, संसारङ्गम गहन वनमां रहेनारा, सना-  
तन अने लाभये ज्ञ ज्ञोवामां आवता अेवा अने परमात्म-  
देवने शुद्ध शुद्धिथी शुक्ता साधक—आश्चात्मज्ञोगनी आभिष्ठी  
ज्ञाणीने शुद्धिभाव शुरुष ऊपर॑ अने शोकने छाडी हे छ। १२

**आच्छ :** ज्ञे आत्माने तमे ज्ञाणाता उच्छ्वो छ। ते अति सुकृत  
होवाने लीघे दुर्दर्श ५३. मुश्केलीथी ज्ञेना॒ दर्शन॑ थर्ह शक्ते तेने दुर्दर्श  
क्लेवाय छ, गूढ अर्थात् गहन स्थानमां अनुप्रविष्ट ओटले शुभदाहि  
आकृत विषयविकारङ्गम विज्ञानथी शुपायेला, शुहा-शुद्धिभां उपलब्ध  
होवाने लीघे तेमां ज्ञ स्थित तथा गह्यरेष्ट—गह्यवर—विष्वम अर्थात्  
अनेक अनेकोथी वेरायेला स्थानमां रहेनारा देवने ज्ञाणीने धीर॑ पुरुष  
५५° अने शोकने छाडी हे छ; ५२ अंडे आत्मा आ अभाणु गूढ  
स्थानमां अवेशेलो अने शुद्धिभां रहेलो छे तेथी ते गह्यरेष्ट छे

તેમ જ ગંડવરેણુ છોનાને લીધે જ હુદ્દેશે છે.

તે પુરાણુ એટસે પુરાતન હેવને, ચિન્ને વિષયોથી દૂર કરીને આત્મામાં જોડવારૂપ અધ્યાત્મયોગની પ્રાપ્તિ વડે જાણીને ધીર પુરુષ પૈતાને ઉત્કષે અને અપકષેનો અભાવ થઈ જવાથી હુષ્ણ—શોઠને જાવે રીતે છોડી હે ૩. ૧૨

વળી :

એતજ્ઞુલ્લા સમ્પરિગૃહ્ય મત્યઃ પ્રવૃત્ત ધર્મ્યમણુમેતમાણ્ય ।

સ મોદતે મોદનીય શ્હિ લદ્ધા વિવૃતસ્યા નચિકેતસં મન્યે ॥

મત્યઃ=મતુષ્ય ( જ્યારે ) એતત્=આ, ધર્મ્યમ્=ધર્મ્યમન ( ઉપદેશને ), શ્રુત્વા=સાંભળીને, સમ્પરિગૃહ્ય=સારી રીતે અહુણુ કરીને, પ્રવૃત્ત= ( અને ) તે પર વિવેકપૂર્વક વિચાર કરીને, એતમ્=આ, અણુ=સૂક્ષ્મ આત્મતત્ત્વને, આણ્ય=જાણીને અનુભાવ કરી લે છે, ( લારે ), ખઃ=તે, મોદનીયમ્=આનંદસ્વરૂપ પરફબ પુરુષોત્તમને, લદ્ધા=પામીને, હિ મોદતે=આનંદમાં જ મનુષ થઈ જાય છે, નચિકેતસમ્= ( તમે ) નચિકેતાને માટે વિવૃતમાં સજ્જ મન્યે= ( હું ) પરમ ધાર્મનાં દ્વાર જીઘડેલાં માનું છું. ૧૩

મતુષ્ય જ્યારે આ ધર્મ્યમન ઉપદેશ સાંભળીને, સારી રીતે અહુણુ કરીને અને તે પર વિવેકપૂર્વક વિચાર કરીનો આ સૂક્ષ્મ આત્મતત્ત્વને જાણીને અનુભાવ કરી લે છે, ત્યારે તે આનંદસ્વરૂપ પરથ્રહા પુરુષોત્તમને પામીને આનંદમાં જ મનુષ થઈ જાય છે. નચિકેતા માટે હું પરમ ધાર્મનાં દ્વાર જીઘડેલાં માનું છું. ૧૩

ભાષ્ય : હવે નેતું હું વર્ણન કરીશ તે આત્મતત્ત્વને સાંભળીને આચાર્યની કૃપાથી સારી પેઢે આત્મભાવથી અહુણુ કરી મરણુધર્મી મતુષ્ય આ ધર્મ્ય—ધર્મ્યવિશિષ્ટ આત્માને શરીર વગેરેથા પૃથ્વી કરીને તથા આ આણુ અર્થાત્ સૂક્ષ્મ અને મોદનીય, હુષ્ણ્યોઽય આત્માને

પ્રામ કરી તે મરણુશીલ વિજાન આનંદ પામે છે. આ પ્રમાણે વિજાન નચિકેતાને મારે હું અનુભાવને ખુલ્લાં બારણુંવાળો હોવાતું માનું છું. અભિપ્રાય એ છે કે, હું તમને અર્થાત્ નચિકેતાને મોક્ષને યોગ્ય હોવાનું માનું છું. તમે મોક્ષને લાયક છો. ૧૩

(નચિકેતા બોલ્યા : ) લગ્વન् ! જો હું મોક્ષને પ્રામ કરવા યોગ્ય હોઉં ને આપ મારા પર પ્રસ્તન હો તો :

ભૂર્ભૂથી અતીત વસ્તુવિષયનો પ્રશ્ન  
અન્યત્ર ધર્મદન્યત્રાધર્મદન્યત્રાસમાતૃતાકૃતાત् ।  
અન્યત્ર ભૂતાચ્ચ ભવ્યાચ્ચ યત્તત્પરયસિ તદ્ગદ ॥૧૪॥

યત્તુ તત્ત્વ=જો તે પરમેશ્વરને, ધર્મત્ત્ર અન્યત્ર=ધર્મભૂથી અતીત, અધર્મત્ત્ર અન્યત્ર=અધર્મભૂથી પણ અતીત, તત્ત્વ=તેમ જે, અસમાત્ત કૃતાકૃતાત્ત=આ કાર્ય અને કારણુંપ સંપૂર્ણ જગતથી પણ, અન્યત્ર= લિન્ન, ચ=અને, ભૂતાત્ત ભવ્યાત્ત=ભૂત, વત્તમાન તેમ જે લવિષ્ય અણે કાળોથી તથા એમની સાથે સંબંધ રાખનારા પદાર્થોથી પણ, અન્યત્ર=પૃથ્ર, પર્યસિ=(આપ) જણો છો, તત્ત્વ=તે, વદ=(મને) ૫હો. ૧૪

જો ધર્મભૂથી અતીત અથીત જીવા છે, અધર્મભૂથી પૃથ્રકું છે અને જો ભૂત, વત્તમાન તેમ જે લવિષ્યથી પણ અન્ય છે ને એ ગણે કાળ સાથે સંબંધ રાખનારા પદાર્થોથી પણ લિન્ન છે—એવું આપ જેને જીવા છો—જણો છો. તે જે મને કહો. ૧૪

ઘાલ્ય : જે ધર્મ એટલે શાસ્ત્રીય ધર્માનુષ્ઠાન, તેનાં ફળ તથા (કર્તા, કરણું વગેરે) કારકોથી પૃથ્ર છે; તેમ જે એ અધર્મભૂથી લિન્ન છે અને કૃત—કાર્ય તથા અકૃત કારણુથી આ પ્રમાણે આ કાર્ય—કારણ(સથૂલ, સુદ્ધમ પ્રચંચ)થી પણ પૃથ્ર છે; એટલું જે નહીં પણ ભૂત અર્થાત્ વીતી ગયેલા, ભવ્ય આવનારા અને વત્તમાન કાળથી

પણ અન્યત્ર છે; તાત્પર્ય એ છે કે જે અણે કાળથી પરિચિન્તન અર્થાતું માપેલ નથી, એવી જે સર્વ વ્યવહારવિષયથી અતીત લિન્ન વસ્તુને આપ જુઓ છો તે મને ઠહો. ૧૪

નચિકૃતાએ ગ્રમાણે પૂછવાથી પૂછેલી વસ્તુ અને તેના અન્ય વિશેષણુને ખતાવવાની છચ્છાથી યમરાને કહું :

### ॐ કારને ઉપદેશ

સર્વે વેदા યત્યદમામનન્તિ તપાંસિ સર્વાણિ ચ યદ્વદન્તિ ।  
યદિચ્છન્તો બ્રહ્મચર્ય ચરન્તિ તત્તે પદંસંગ્રહેણ બ્રવીમ્યોમિત્યેતત् ॥

સર્વે વેદાઃ=સર્વ વેદો, યત્ત પદમ्=જે પરમ પદનું, આમનન્તિ=વાર-  
વાર પ્રતિપાદન કરે છે, ચ=અને, સર્વાણિ તપાંસિ=સર્વ તપો, યત્ત=જે પદનું  
વદન્તિ=લક્ષ્ય કરાવે છે, અર્થાતું તે જેનાં સાધન છે, યત્ત ઇચ્છન્તઃ=જેને  
યાહુનારા સાધુકગણું, બ્રહ્મચર્યમ्=બ્રહ્મચર્યંતું, ચરન્તિ=પાલન કરે છે,  
તત્ત પદમ्=તે પદ, તે=તમને ( હું ) સંગ્રહેણ=સંક્ષેપથી, બ્રવીમિ=કહું છું,  
( તે છે ) ઓમ્ર=ઓમ, ઇતિ=એવો, એતત્=આ ( એક અક્ષર ). ૧૫

સર્વ વેદો જે પદનું વ્યાખ્યાન કરે છે, સર્વ તપોને  
જેની પ્રાપ્તિનાં સાધન કહેવામાં આવે છે, જેની છચ્છાથી  
( સુસુક્ષુ જન ) બ્રહ્મચર્યંતું પાલન કરે છે, તે પદ હું  
તમને સંક્ષેપમાં કહું છું. આ ‘ॐ’ જે તે પદ છે. ૧૫

**ભાષ્ય :** સર્વ વેદો જે પદ અર્થાતું ગમન કરવાના સ્થાનતું  
અવિલાગ રૂપથી અર્થાતું એકરૂપથી આમનન-પ્રતિપાદન કરે છે. સર્વ  
તપો પણ જેના માટે જો હોવાનું કહે છે, અર્થાતું એ તપો જે સ્થાનની  
પ્રાપ્તિ માટે છે, જેની કામનાથી ગુરુગૃહમાં નિવાસરૂપ બ્રહ્મચર્ય અથવા  
બ્રહ્મપ્રાપ્તિમાં ઉપયોગી અન્ય જોઈને સાધન બનાવે છે તે પદને, જેને  
કે તમે જાણુવા ચાહો છો તેને હું સંક્ષેપમાં કહું છું. આ ‘ॐ’ જે  
તે પદ છે, આ જે ‘ॐ’ છું એટલે જે ‘ॐ’ શબ્દનું વાચ્ય ને ‘ॐ’ જે

નેનું પ્રતીક છે, તે જ તે પદ છે, નેને તમે જણુના યાણો છો. ૧૫  
એટલા માટે-

એતद્ગ્યોવાક્ષરં બ્રહ્મ એતદ્ગ્યોવાક્ષરં પરમ् ।

એતદ્ગ્યોવાક્ષરં જ્ઞાત્વા યો યદિચ્છતિ તસ્ય તત् ॥ ૧૬ ॥

એતત्=આ, અક્ષરમ् એવ હિ=અક્ષર જ, બ્રહ્મ=બ્રહ્મ છે, ( નેને )  
એતત्=આ, અક્ષરમ् એવ હિ=અક્ષર જ, પરમ्=પરબ્રહ્મ છે, હિ=તેથી,  
એતત् એવ= આ જ, અક્ષરમ्=અક્ષરને, જ્ઞાત્વા=જણુને, યઃ=જે, યત્=નેને  
ઇચ્છતિ=ઇચ્છે છે, તસ્ય=તેને, તત्=તે જ ( ભણી જય છે ). ૧૬

આ અક્ષર જ બ્રહ્મ છે, આ અક્ષર જ પર છે; આ  
અક્ષરને જ જણુને જે ઇચ્છા કરે છે તે જ તેનું થઈ  
જય છે. ૧૬

**ભાષ્ય :** આ અક્ષર જ અપર બ્રહ્મ છે ને આ અક્ષર જ પર-  
બ્રહ્મ છે. આ અક્ષર, તે એનેયનું પ્રતીક છે. આ અક્ષરને જ ‘આ  
જ ઉપાસ્ય બ્રહ્મ છે’ એવું જણુને ને પર અથવા અપર જે બ્રહ્મની  
ઇચ્છા કરે છે તેને તે જ પ્રાપ્ત થઈ જય છે. જે તેનું ઉપાસ્ય પરબ્રહ્મ  
હોય તો માત્ર જણું શકાય છે ને જે અપર બ્રહ્મ હોય તો પ્રાપ્ત  
કરી શકાય છે. ૧૬

આમ છે તેથી-

એતદાલમ્બનં શ્રેષ્ઠમેતદાલમ્બનં પરમ् ।

એતદાલમ્બનં જ્ઞાત્વા બ્રહ્મલોકે સહીયતે ॥ ૧૭ ॥

એતત्=આ જ, શ્રેષ્ઠમ्-અતિ ઉત્તમ, આલમ્બનમ्=આલાંબન છે,  
એતત्=આ જ ( સર્વનું ), પરમ् આલાંબન=અતિમાન આલાંબન છે, એતત्=આ,  
આલમ્બનમ्=આલાંબનને, જ્ઞાત્વા=જણુની જાતિ, જણુને ( સાધક ), બ્રહ્મલોકે=  
બ્રહ્મલોકમાં, મહીયતે=ગૌરવશાળા યાય છે. ૧૭

આ શ્રેષ્ઠતાર જ પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિને માટે સર્વ-

ગ્રંથાનાં આલાંખનોમાંથી સર્વાશી એષુ આલાંખન છે ને  
આ જ સર્વાને રહાતિમ આશ્રમ છે. એનાથી અતથ કોઈ  
આલાંખન નથી. આ રહસ્યને સારી પેઠે જાણીને જે સાધક  
શક્તા અને પ્રેમથી ઓને આશ્રમે રહે છે તે અરેખર  
પરમાત્માની પ્રાતિકું પરમ ગૌરવ પામે છે. ૧૭

**ભાષ્ય :** આ ( અંકારઃપ ) આલાંખન અણપ્રામિતાં ( ગાયત્રી  
વગેરે ) સર્વ આલાંખનોમાં એષ અર્થાત્ સર્વ કરતાં વધુ પ્રરાસનીય  
છે. પર અને અપર અત્યાવિપયડ હોવાને લીધે આ આલાંખન પર અને  
અપરઃપ છે; તાત્પર્ય એ છે કે, આ આલાંખનને જાણીને સાધક અણ-  
દોક અર્થાત્ પરશ્રમમાં સ્થિત થઈને ગૌરવશીલ બને છે, ને અપર  
અણમાં અણત્વને પામી અણની પેણ ઉપાસનીય થાય છે. ૧૭

ઉપર કહેલા ‘અન્યત્ર ધર્મત્ત’ વગેરે શ્લોકની નિયિદ્ધેતાએ  
પૂછેલા સર્વ વિશેષરહિત આત્માનો તથા મંદ અને ભાષ્યમ ઉપાસકો  
માટે અપર અણના પ્રતીક અને આલાંખનઃપથી અંકારનો નિર્દેશ  
કરવામાં આવ્યો. હવે જેનું આલાંખન અંકાર છે તે આત્માના સ્વરૂપનો  
સાક્ષાત् નિર્ણય કરવાની છણાથી આ કહેવામાં આવે છે:

### આત્મસ્વરૂપનિર્દ્દિપણ

ન જાયતે મ્રિયતે વા વિપશ્ચિત્તાયં કુતશ્ચિત્ત બમૂવ કથિત્ત |  
અજો નિત્યઃ શાશ્વતોऽયં પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે ||

વિપશ્ચિત્ત=નિત્ય શાનસ્વરૂપ આત્મા, ન જાયતે=અન્ય-મતો નથી,  
ન વા મ્રિયતે=તેમ મરતો પણ નથી; અયમ् ન=ન તો આ પોતે,  
કુતશ્ચિત્ત=કોઈથી થયો છે, ( ન ) ( એનાથી ), કથિત્ત=કોઈ પણ  
બમૂવ=થયું છે અર્થાત્ આ જોઈનું હોય નથી, તેમ કોઈનું કારણું પણ  
નથી, અયમ्=આ, અજો=અન્ય-જા; નિત્યઃ=નિત્ય, શાશ્વતો=હોશાં એક-  
સર્વાણિ ( અને ) પુરાણો=સુસ્તાન છે એવલે તે ક્ષવ અને વૃદ્ધિથી

રહિત છે, શરીરે હન્યમાને=શરીરનો નાશ કરવામાં આવ્યા પછી પણ ( એનો ), ન હન્યતો=નાશ કરી શકાતો નથી. ૧૮

આ વિપશ્ચિત-મેધાવી આત્મા ઉત્પજ્ઞ થતો નથી તેમ મરતો પણ નથી; આ પોતે કોઈથી થયો નથી તેમ એનાથી પણ કોઈ થયું નથી; અર્થાતું આ કોઈનું કાર્ય નથી તેમ કોઈનું કારણું પણ નથી. આ અજ્ઞાત્મા, નિત્ય, હુમેશાં એકસરણો. રહેનારો અને પુરાતન છે એટલે કે ક્ષય અને વૃદ્ધિથી રહિત છે. શરીરનો નાશ થયા પછી પણ એનો નાશ કરી શકાતો નથી-એનો નાશ થતો નથી. ૧૮

**ભાષ્ય :** આ આત્મા ઉત્પજ્ઞ થતો નથી તેમ મરતો પણ નથી. ઉત્પજ્ઞ થનારો અનિત્ય વસ્તુમાં અનેક વિકાર હોય છે. અહીં આત્મામાં સર્વ વિકારાનો અતિષેધ કરવા માટે ‘ન જાયતે મ્રિયતે કા’ આમ કહીને સર્વથી પ્રથમ તેમનામાંના જ્ઞ-મ અને વિનાશરૂપ આદ્વિતીને અંતના વિકારાનો નિષેધ કરવામાં આવે છે. ક્યારેય લુસ ન થતારા ચૈતન્યરૂપ સ્વભાવને લીધે આત્મા વિપશ્ચિત અર્થાતું મેધાવી છે.

વળી આ આત્મા ક્યાંકથી અર્થાતું છોઈ અન્ય કારણુથી ઉત્પજ્ઞ થયો નથી તેમ અર્થાતરરૂપે પોતાનાથી પણ થયો નથી. એટલા માટે આ આત્મા અજ્ઞાત્મા, નિત્ય અને શાશ્વત અર્થાતું ક્ષયરહિત છે, કેમ કે જે અશાશ્વત હોય છે તે જે ક્ષીણું હોય છે. આ તો શાશ્વત છે તેથી પુરાતન પણ છે; અર્થાતું પ્રાચીન હોઈને પણ નવીન જ છે; કારણું કે જે પદાર્થ અવયવોના ઉપયુક્ત( મેલ )થી નિષ્પત્ત કરાય છે તે જે ‘અત્યારે નવો છે’ એમ કહેવાય છે, જેમ કે ધડો; પરંતુ આત્મા તેનાથી વિપરીત સ્વભાવવાળો છે એટલે તે પુરાણુ-પુરાતન એટલે વૃદ્ધિથી રહિત છે. એ એવો હોવાથી શરૂઆદિ વડે શરીરનો વધ કરવામાં આવ્યા છતાંય તે મરતો નથી. તેની હિંસા કરી શકતી

નથી; અર્થાત् શરીરમાં રહીને પણ તે આકાશની પેઢે નિર્દિષ્ટ જ છે. ૧૮

હન્તા ચેન્મન્યતે હન્તુ ઽહતશેન્મન્યતે હતમ् ।

ઉભૌ તૌ ન વિજાનીતૌ નાય�હન્તિ ન હન્યતે ॥ ૧૯ ॥

ચેત=જોડોઈ, હન્તા=મારનાર વ્યક્તિ, હન્તુમ્ર=મારવામાં પોતાને સમર્થ, મન્યતે=( છોવાનું ) માને છે ( અને ), ચેત=જો, હતઃ=( કોઈ ) મરનારો, હતમ્ર=પોતાના આત્માને મરાલો, મન્યતે=માને છે ( તો ) તો ઉભૌ=તે ખંનેય, ન વિજાનીતઃ=( આત્મસ્વરૂપને ) જાળુતા નથી; ( કેમ તે અયમ્ર=આ આત્મા, ન હન્તિ=( કોઈને ) મારતો નથી ( તેમ ), ન હન્યતે=કોઈથી મરાતો પણ નથી. ૧૯

એ કોઈ મારનાર જ્યક્તિ આત્માને મારવામાં પોતાને સમર્થ છોવાનું માને છે અને મરનારો તેને ( પોતાના આત્માને ) મરાયેલો માને છે; તો તે ખંનેય જણ્ણા તે- ( આત્મસ્વરૂપ )ને જાળુતા નથી; કેમકે આત્મા કોઈને મારતો નથી તેમ તે કોઈથી મરાતો નથી. ૨૦

**માણ્ય :** એવા પ્રકારના આત્માને પણ કેવળ દેહને જ આત્મા માનનારો કોઈ પુરુષ જો કોઈને મારવાનો વિચાર કરે છે ને એમ માને છે કે હું એને મારીશ; તેમ જ બીજો મરનારો પણ ‘હું મરાયો છું,’ એમ પોતાના આત્માને મરાયેલો છોવાનું માને તે ખંને જણ પોતાના આત્માને જાળુતા નથી; કારણું કે આત્મા અવિકારી છે તેથી તે મારી શકતો નથી, તેમ જ આકાશની પેઢે અવિકારી છોવાથી તેને મારી પણ શકતો નથી, એટલા માટે ધર્માધ્યમાદ્વિપ સાંસાર આત્માને ન જાળુનારાની જ સાથે સંબંધ રાખે છે, અહિને જાળુનારા સાથે સંબંધ રાખતો નથી; કેમ કે શુતિના પ્રમાણથી અને ચુક્કિથી પણ અબજાની વડે ધર્મ-અધર્મ વગેરે ( કાર્યો ) થઈ શકતો નથી.

આમ છે તો પણી સુમુક્ષુ પુરુષ આત્માને કયા ઝિપથી જાણે છે, એ વિષે કહે છે:

અણોરણીયાન્મહતો મહીયાનાત્માસ્ય જન્તોનિહિતો ગુહાયામ् ।  
તમક્રતુઃ પદ્યતિ વીતશોકો ધાતુપ્રસાદાન્મહિમાનમાત્મનઃ ॥

અસ્ય જન્તોઃ=આ જીવાત્માના, ગુહાયામ્=હૃદયરૂપ શુદ્ધામાં, નિહિતઃ=રહેનારો, આત્મા=પરમાત્મા, અણો: અણીયાન=સૂક્ષ્મથી અતિસૂક્ષ્મ (અને), મહતઃ: મહીયાન=મહાનથી પણું મહાન છે, આત્મનઃ: તમ્મ મહિમાનમ્=પરમાત્માના તે મહિમાને, અક્રતુઃ=કામનારહિત (અને), વીતશોકો=ચિંતારહિત (ક્રોધ વિરલ સાધક), ધાતુપ્રસાદાત=સર્વનો આધાર પરથ્રણ પરમેશ્વરની દુપાથી જ, પદ્યતિ=જોવા પામે છે. : ૦

આણુથી પણ આણું ને મહાનથી પણું મહાન આ આત્મા જીવની હૃદયરૂપ શુદ્ધામાં રહેલો છે. નિષ્ઠામ અને ચિંતારહિત ક્રોધ વિરલ પુરુષ જ પોતાની ઈદ્રિયો-ના ગ્રસાદથી અર્થાતું સર્વના આધાર પરથ્રણ પરમેશ્વર-ની દુપાથી જ પરમાત્માના તે મહિમાને જોવા પામે છે.

**ભાષ્ય :** આત્મા આણુથી પણ અણું અર્થાતું સામા વગેરેના સૂક્ષ્મ કણુથી પણ સૂક્ષ્મતરે તેમ જ મહાનથી પણું મહાન અર્થાતું પૃથ્વી વગેરે મહત્ત્વ પરિમાળુવાળા પદ્ધાર્થોથી પણું મહત્તર છે. સંસારમાં આણું જીવવા મહત્તપરિમાળુવાળી ને ક્રોધ પણું વસ્તુ છે તે નિત્ય-સ્વરૂપ ને આત્માથી જ આત્મવાન (સ્વરૂપ સત્તાયુક્ત) થઈ શકે છે. આત્માથી ત્યજન્તાં તે અસ્તિત્વ વિનાની અર્થાતું સત્તારહિત થઈ જાય છે. માટે આ આત્મા જ આણુથી આણું ને મહાનથી પણ મહાન છે: કારણ કે નામ અને ઇપવાળી સર્વ વસ્તુઓ એની ઉપાધિ છે. કે કષ..ના જ અણાથી લઈ તણુખલા સુધી સર્વ પ્રાણીસમુદ્ધાયની ફુડામાં રહેલો છે; અર્થાતું અંતરાત્મરૂપથી સ્થિતિ છે,

જોતું, સાંભળણું, મનન કરણું અને જાણું એ જેનાં લક્ષણો છે તે આત્માને અફતુ-નિષ્કામ પુરુષ અર્થાત् જેની ખુદ્દિ દૃષ્ટિ અને અદૃષ્ટ વાલું વિષયોથી વિરામ પામેલો છે; કારણું કે જ્યારે આવી સ્થિતિ થાય છે, ત્યારે જ મન વગેરે ઉદ્દિશ્યો જોડે શરીરને ધારણ કરવાને લિધે ધાતુ કહેવાય છે તે—પ્રસત્ત થાય છે; આ ધાતુઓ પ્રસત્ત થવાથી તે પોતાના આત્માના કર્મના નિમિત્તને લઈને વૃદ્ધિ અને ક્ષયરહિત મહિમાને જુયો છે; અર્થાત् આ નાતને તે ચોક્કસપણું જાણે છે કે, ‘હું આ (આત્મા) જુ,’ (આ જાણીને) પછી તે શાકરહિત થઈ જય છે. ૨૦

એ સિનાય સંકામ પ્રાકૃત ભાષણસો માટે આ આત્મા અતિ દુર્વિજ્ઞય છે; અર્થાત् ધર્મી મહેનતે પણ જાણી શકાય તવા નથી કારણું કે :

આસીનો દૂરં બ્રજતિ શયાનો યાતિ સર્વતः ।  
કસ્તં મદામદં દેવં મદન્યો જ્ઞાતુમર્હતિ ॥ ૨૧ ॥

આસીનઃ=(તે પરમેશ્વર) બેઠેલો જ, દૂરં બ્રજતિ=દૂર પહોંચી જય છે, શયાનઃ=સૂતેલો (પાણ), સર્વતઃ યાતિ=અધી ખાળુંચે ચાલતો રહે છે, તમ્ મદામદમ् દેવમ्=તે ઐશ્વર્યના મહથી ઉન્મતા ન થનારા હેવને, મદન્યઃ કઃ=મારાથી ખીજું છોણુ, જ્ઞાતુમ્=જાણુવાને માટે, અર્હતિ=સમર્થ છે. ૨૧

તે (પરમેશ્વર) બેઠા હોવા છતાં અર્થાત્ અચલ હોવા છતાં પણ દૂર સુધી જય છે, સૂતા હોવા છતાં પણ અધી ખાળુંચે ચાલતા રહે છે. ઐશ્વર્યના મહથી ઉન્મતા ન થનારા તે હેવને જાણુવાને અધિકારી તેમનો કુપાપાત્ર મારા (આત્મતર્વને જાણુનારા યમરાજ જેવા અધિકારી) વિના જાણી ખીજે કોણું હોઈ શકે ? ૨૧

**માણ્ય :** અચળ રહીને પણ તે લાંબે ચાહ્યો જય છે, સૂતો રહીને પણ તે બધી બાળુએ પહોંચે છે. આ પ્રમાણે તે આત્મા દેવ સમદ્દિની અમદ્વારા અથડાં હર્ષ સહિત અને હર્ષરહિત વિરુદ્ધ ધર્મવાળો છે. તેથી જાગુવામાં આવી શકે તેવા ન હોવાથી તે મદ્દુકૃત અને મદ્રહિત દેવને મારા વિના ખીજું ડાણ જાણી શકે એમ છે? આ આત્મા અમારા જેવા જ્ઞાનમણુદ્ધિ વિદ્યાને માટે જ સુવિજેય છે. સ્થિતિ, ગતિ તેમ જ નિત્ય અને અનિત્ય વગેરે અનેક વિરુદ્ધ ધર્મરૂપ ઉપાધિવાળો અને વિપરીત ધર્મવાળો હોવાથી આ ચિંતામણિની પેઢે વિશ્વરૂપ સરણો ભાસો છે, તેથી ‘મારા સિવાય ખીંચે ડાણ તેને જાણુવા યોગ્ય છે?’ એમ કહીને આત્માની હુવિજ્ઞેયતા દેખાડે છે. હંદ્રિયેનું શાંત થઈ જાણું તે શયન છે. ’ શયન કરનારા પુરુષનું હંદ્રિયજનિત એકદેશ સંબંધી વિજ્ઞાન શાંત થઈ જાય છે. જે સમયે આવી અવસ્થા હોય છે તે સમયે ડેવળ સામાન્ય વિજ્ઞાન હોવાથી તે બૂધી બાળુએ જતો હોય તેમ જાણ્યાય છે ને જ્યારે તે વિશેષ વિજ્ઞાનમાં સ્થિત થાય છે ત્યારે તો સ્વરૂપથી અવિચળ રહીને પણ મન વગેરે ઉપાધિઓવાળો હોવાથી મન વગેરેની તે ગતિઓમાં જતો હોય તેમ જાણ્યાય છે. ખરી રીતે તો અહીં જ રહે છે. ૨૧

હવે તે આત્માનું શાન થવાથી શોકનો અંત થઈ જાય છે, એ દશાવિ છે :

**अशरीं शरीरेष्वनवस्थेष्ववस्थितम् ।**

**महान्तं विभुमात्मानं मत्वा धीरो न शोचति ॥ ૨૨ ॥**

અનવસ્થેષુ=( જ ) સ્થિર ન રહેનારાં ( વિનાશશીલ ), શરીરેષુ=શરીરામાં, અશરીરમ્=શરીરરહિત ( તેમ જ ), અવસ્થિતમ્=અવિચળ ભાવથી સ્થિત છે, મહાન્તમ્=( તે ) મહાન, વિભુમ્=સર્વવ્યાપી, આત્માનમ્ પરભાત્માને, મત્વા=જાણીને, ધીરઃ=ખુદ્ધિમાન મહાપુરુષ, ન શોચતિ=( ક્યારેય ડેઈ પણ કારણથી ) શોક કરતો નથી, ૨૨

સ્થિર ન રહેનારાં વિનાશશીલ શરીરોમાં જે શરીર-  
રહિત તેમ જ અવિચળ ભાવથી સ્થિર છે, તે મહાન  
સર્વોધારી પરમાત્માને જાણુને ખુદ્ધિમાન પુરુષ કોઈ  
પણ કારણુથી કથારેય શોક કરતો નથી. ૨૨

**ભાગ્ય :** આત્મા પોતાના સ્વરૂપથી આકૃષ સમાન છે તેથી  
દેવ, પિતૃ અને ભતુષ્ય વગેરેનાં શરીરોમાં અશરીર છે, અનવસ્થિત  
અવસ્થાતિરહિત અર્થાતું અનિત્યોમાં અવસ્થિત નિત્ય એટલે અવિ-  
કારી છે તથા મહાન છે. ( કેનાથી મહાન છે કે આ પ્રમાણે ) મહત્વમાં  
અન્યાની અપેક્ષા હોવાની શક્તા કરીને કહે છે કે તે વિલુણ અર્થાતું  
વ્યાપક આત્માને જાણુને—અહીં ‘આત્મા’ શાખા પોતાના કરતાં અહાન  
‘યુદ્ધ’ નથી એમ દૈખાડવા માટે લેવામાં આવ્યો છે; કેમ કે ‘આત્મા’  
શાખા પ્રત્યગાત્મવિષયમાં જ મુખ્ય છે—એવા તે આત્માને ‘આ જ હું છું’  
એમ માનીને ધીર-ખુદ્ધિમાન પુરુષ શોક કરતો નથી; કારણ કે આ  
પ્રકારના આત્મવેતામાં શોક છોઈ જ શકતો નથી. ૨૨

ઓકે આ આત્મા દુર્વિજ્ઞેય છે તો પણ ઉપાય કરવાથી તે સુવિ-  
સેય જ અર્થાતું સહેલાઈથી જાણી શકાય તથો છે, તે વિષે કહે છે :

**આત્મા આત્મકુપાથી સાધ્ય છે**

નાયમાત્મા પ્રવચનેન લભ્યો ન મેઘયા ન બહુના શ્રુતેન ।  
યમેવૈષ વૃણુતે તેન લભ્યસ્તસ્યૈષ આત્મા વિવૃણુતે તનૂઽસ્વામ્ ॥

અયમ् આત્મા=આ પરાત્મા પરમાત્મા, ન= નહીં, પ્રવચનેન=પ્રવચન-  
થી, ન મેઘયા=ખુદ્ધિથી નહીં, ( અને ) ન બહુના શ્રુતેન=ધાણ સાંભળવાથી  
પણ નહીં, લભ્ય.=આમ થઈ શકે છે, યમ્=નેને, એષ:=આ, વૃણુતે=  
સ્વીકાર કરી લે છે, તેન એવ લભ્યઃ =તેનાથી જ આમ કરી શકાય છે,  
( કેમ કે ) એષઃ આત્મા=આ પરમાત્મા, તસ્ય=તેના માટે, સ્વામ् તનૂઽ=  
પોતાના યથાર્થ સ્વરૂપને, વિવૃણુતે=પ્રકટ કરી દે છે.

આ પરખણું પરમાત્મા વેદાધ્યબન વડે આમ થવા ચોગ્ય નથી તેમ જ ધારણાશક્તિ અથવા ધણું સાંલળવાથી પણ ગ્રામ થઈ શકતો નથી. આ ( સાધક ) જે(આત્મા)નું વરણું કરે છે—સ્વીકાર કરી લે છે તેનાથી જ આ ( આત્મા ) આમ કરી શકાય છે. આ પરમ આત્મા તેના પ્રતિ પોતાના સ્વરૂપને પ્રકટ કરે છે.

**ભાષ્ય :** આ આત્મા પ્રવચન અર્થાત્ અનેક વેદાનો સ્વીકાર કરવાથી આમ થવા ચોગ્ય અર્થાત્ જાળી શકાય લેવા નથી, તેમ જ મેધા એટલે અંથના અર્થને ધારણા કરવાની શક્તિથી અને ડેવળ ધણું શ્રવણું કરવાથી પણ જાળી શકાય તેમ નથી. તો પછી કથા પ્રકારથી તે પ્રાસ કરી શકાય છે તે કહે છે.

આ સાધક જે આત્માનું વરણું કરે છે અર્થાત્ ગ્રાથના કરે છે તે વરણું કરતારા આત્મા વડે આ આત્મા પોતે જ પ્રાસ કરાય છે; અર્થાત્ તેનાથી જ ‘આ આવો છે’ આ ગ્રામણું જાળવામાં આવે છે. તાત્પર્ય એ છે કે, ડેવળ આત્મલક્ષાલને મારે જ ગ્રાથના કરતારા નિષ્કામ પુરુષને આત્મા વડે જ આત્માની ઉપલબ્ધિ થાય છે. કહી રીતે ઉપલબ્ધિ થાય છે, તે વિષે કહે છે. તે આત્માના અલિકાણી પ્રતિ આ આત્મા પોતાના પારમાધિક સ્વરૂપ અર્થાત્ પોતાના યાથાત્પર્યને પ્રકાશિત કરે છે. ૨૩

એ સિવાય બીજી વાત આ પણ છે :

**આત્મલક્ષાલનો આનથિકારી**

**નાવિરતો દુશ્ચરિતાનાશાન્તો નાસમાદિતઃ ।**

**નાશાન્તમાનસો વાપિ પ્રજ્ઞાનેનમાન્યુયાત् ॥ ૨૪ ॥**

પ્રજ્ઞાનેન=સૂક્ષ્મ ખુદી ૧૩, અપિ=પણ એનમ્ય=આ પરમાત્માને, ન દુશ્ચરિતાત् અવિરતઃ આન્યુયાત्=દુરાચરણાથી નિવૃત્તિ થયા સિવાય તે

પ્રામ કરી શકતો નથી. ન અશાન્તઃ=ને અશાન્ત છે તે પ્રામ કરી શકતો નથી, ન અસમાહિતઃ=મન અને ઈદ્રિયો જેના ઝાણુમાં નથી તે, વા=અને, ન અશાન્તમાનસઃ ( આસ્તુયાત् )=તેમ જે જેનું મન શાંત નથી તે પણ ( આ પરમાત્માને ) પ્રામ કરી શકતો નથી. ૨૪

(૨) દુરાચરણુથી અટક્યો નથી, કેળી ધંદ્રિયો શાંત થઈ નથી અને જેનું ચિત્ત શાંત નથી તે માણુસ એને ( પરમાત્માને ) પ્રામ કરી શકતો નથી. ૨૪

**ખાલ્ય :** દુષ્ટ આચરણુમાં અને શુતિરમૃતિઓ નિષેધેલાં કર્મોમાં રહ્યોપરયો રહેનારો, ઈદ્રિયોની લોલુપતાને લઈને આશાંત, વ્યાજ તથા વિશ્વિસ ચિત્તવાળો, તેમ જે અનું સમાધાન થયેલું હોવા છતાં પણ એકાશતાના ઇળની ચૂંગા રાખવાથી અશાંત ચિત્તવાળો તથા નિરંતર કાભમાં રોકાયેલા મનવાળો મનુષ્ય આ ઉપર જાણાવેલા આત્માને આત્મમશ્યાન દ્વારા પ્રામ કરી શકતો નથી. અર્થાત પાપકર્મ અને ઈદ્રિયોની ચંચળતાથી દૂર રહેનારો, સ્વસ્થ ચિત્તવાળો અને સમાધાનનું ઇળ મળવાથી શાંત ચિત્તવાળો, આચાર્યવાન સાધક જે અનિરાન દ્વારા આત્માને મેળવી શકે છે.

પરંતુ જે સાધક એવા નથી તેના વિષયમાં શુલી કહે છે :

યस્ય બ્રહ્મ ચ ક્ષત્રં ચ ઉમે ભવત ઓદનઃ ।

મૃત્યુર્યસ્યોપસેવનં ક ઇત્યા વેદ યત્ર સः ॥ ૨૫ ॥

યસ્ય=( સંહારકાળમાં ) જે પરમેશ્વરના, બ્રહ્મ ચ ક્ષત્રમ् ચ ઉમે=અનિષ્ટ અને ક્ષત્રિય—આ વાને અર્થાતુ આણુમાં, ઓદનઃ=ણોરાસ, ભવતઃ=અની જ્યથ છે ( તેમ જે ), મૃત્યુઃ યસ્ય=સર્વાનો સંહાર કરનાર મૃત્યુ ( પણ ) જેનું, ઉપસેવનમ्=ઉપસેવન ( વ્યાજન-શાકલાળ, ચટણી, અધારું વગેરે ), ભવતિ=અની જ્યથ છે, સः યત્ર=તે પરમેશ્વર જ્યાં ( અને ), ઇત્યા=જેવો છે, એવો અરાણર, કઃ વેદ=ઝાણુ જાણુ છે ?

ને આત્માના ખ્રાદ્ધણુ અને ક્ષત્રિય આ ખજે ઓછાન-  
ભાત ( ઓરાક ) છે તથા મૃત્યુ જેનું ઉપસેયન ( શાંક  
વગેરે ) છે તે જ્યાં છે તેને કયો ( અજ પુરુષ ) આ  
પ્રમાણે ( ઉપર કહેલા સાધન-સંપત્ત અધિકારીની પેટ )  
જાણી શકે છે ? ૨૫

**ભાષ્ય :** સર્વ ધર્મોનિ ધારણુ કરનારા અને સર્વાના રક્ષક હાવા  
છતાંય ખ્રાદ્ધણુ અને ક્ષત્રિય આ બંને વણ્ણો ને આત્માના ઓછાન-  
ઓરાક છે તેમાં જ સર્વાનો સંહરક મૃત્યુ પણ જેનું ભાત સાથે  
ખાવા માટેનું ઉપસેયન અર્થાત् શાંકલાલ સમાન છે એટલે કે  
લોજન માટે પણ પૂરતું નથી, તે આત્માને, જ્યાં તે છે, એવો  
ઉપર કહેલાં સાધનોથી રહિત અને સાધારણુ ખુદ્ધિપાળો કયો પુરુષ  
છે, ને આ પ્રમાણે—ઉપર કહેલા સાધનસંપત્ત પુરુષની પેટ જાણી શકે ?

શ્રીમત્પરમાહંસ પરિત્રાજકાચાર્ય બાગવાન શ્રીશાંકરાચાર્યે રચેલા

કઢોપનિષદ્ધના પથમ અધ્યાયમાં દ્વિતીય વહીબાધ્ય સમાપ્તા

## ત્રીજ વધ્દી

### આમ થનારા અને પ્રામણ્ય લેદથી એ આત્મા

**માણ્ય :** આ ‘ક્રતં પિવન્તૌ’ વગેરે ત્રીજ વધ્દીનો સંબંધ આ પ્રમાણે છે : ત્રીજ વધ્દીમાં વિદ્યા અને અવિદ્યાને નાના પ્રકારના વિશ્લેષણીઓ વિવામામાં આવી છે; પરંતુ તેમનો ઇન્હેં સહિત ચોખ્ય રીતે નિષ્ટાય કરવામાં આવ્યો નથી. એટલે તેમના ચોખ્ય નિષ્ટાય માટે (આ વધ્દીમાં) રથના ઉપકની કલ્પના કરવામાં આવી છે. એથી (વિદ્યા-અવિદ્યાને) સમજવામાં સરળતા થાય છે. એવી જ રીતે પ્રામથનારા અને પ્રામણ્ય સ્થાન તથા ગમન કરનારા અને ગંતવ્ય લક્ષ્યને વિદેશ કરવાને માટે એ આત્માઓનો વિચાર કરવામાં આવે છે :

**ક્રતં પિવન્તૌ સુકૃતસ્ય લોકે ગુહાં પ્રવિષ્ટૌ પરમે પરાર્થે ।**

**છાયાતપૌ બ્રહ્મવિદો વદન્તિ પञ્ચાગ્રયો યે ચ ત્રિણાચિકેતાઃ ॥**

સુકૃતસ્ય લોકે=થુલા કર્મોના ઇન્હાનુભૂતિશરીરમાં, પરમે પરાર્થે=પરામ્રબ્ધના ઉત્તમ નિવાસસ્થાન(હૃદય-આકાશ)માં, ગુહામૃ પ્રવિષ્ટૌ=બુદ્ધિ-રૂપી ગુરૂમાં સંતાપેતા, ક્રતમ્ પિવન્તૌ=સત્યનું પાન કરનારા (એ છે), છાયાતપૌ=છાયા અને આત્મ(તડકા)ની પેહે પરસ્પર લિંગ છે; (આ વાત) બ્રહ્મવિદો=બ્રહ્મવેતા જ્ઞાની મહાપુરુષો, વદન્તિ= કહે છે. ચ યે=અને જેણો, ત્રિણાચિકેતાઃ=ત્રણુવાર નાચિંક્લા અનિનું ચયન કરનારા (તે) પञ્ચાગ્રયઃ=પંચાગ્રયાંની ઉપાસતા કરનારા ગૃહસ્થ છે; (તે) વદન્તિ=તેણો પણ આ જ વાત કહે છે. ૧

બ્રહ્મવેતાઓ કહે છે કે, શરીરમાં બુદ્ધિઝ્ઞપ ગુરૂની અંદર પ્રકૃત-ઉત્તમ બ્રહ્મસ્થાનમાં પ્રવેશને પોતાનાં કર્મ-ઇણને લોગવનાર છાયા અને તડકાની જેમ પરસ્પર વિદ્યાણુ-લિંગ એ રારવ છે. આ જ વાત, જેમણે નાચિંક્લેત

અશીનું ત્રણ વાર ચચન કથું છે તે પંચામિની ઉપાસના કરનારાઓ પણ કહે છે. ૧

**ભાષ્ય :** અતુ અર્થાત् અવશ્યલાવી હોવાને લીધે સત્ય કર્મ-ઇળતું પાન કરનારા એ આત્મા છે; જેમાનો એક કર્મના ઇળને બોગવે છે, જ્યારે બીજે બોગવતો નથી; તો પણ કર્મફળને બોગવનારા આત્મા સાથે સંબંધ હોવાને લીધે અહીં છત્તીન્યાયથી એને માટે ‘પિવન્તૌ’ આ દ્વિવચનનો અયોગ થયેલો છે. સુદૃત એટલે પોતે કરેલાં કર્મના ઇળ બોગવતા રહીને,—અહીં ‘સુકૃતસ્ય’ શાખનો પૂર્વવત્તાં ‘ત્રણમ्’ શાખની સાથે સંબંધ છે. લોક અર્થાત્ આ શરીરમાં ગુહામાં ખુદ્દિની આદર પરમ-આત્મા દેહાન્તિ ચાકાશ-સ્થાનની અપેક્ષાઓ ઉત્કૃષ્ટ પરખના ચાપ્ય અર્થાત્ સ્થાનમાં પ્રવેશેલા છે, કેમ કે તેમાં જ પરખની પ્રાપ્તિ થાય છે, માટે તે (એને આત્મા) પરમ પરાપ્રી અર્થાત્ હદ્યાકાશમાં પ્રવેશેલા છે એવું કહેવાનું તાપ્ય છે. તે એને સંસારી જાને અસંસારી હોવાને લીધે છાયા અને તડકાની જેમ ઓકળીની જીવા છે—બિન છે જોમ અભવેતાઓ વર્ણન કરતાં કહે છે. કર્મ નહિ કરનારા અભવેતા ઓકલો જ તેવા આમ કહે છે, જોમ નથી પરંતુ જેઓ ત્રણાચ્છિત છે—જેમણે ત્રણવાર નાચિ-કેલ અભિનું ચચન કથું છે, તે પંચામિની ઉપાસના કરનારા ગૃહસ્થા પણ જોમ જ કહે છે. ૧

જ ઘણા માણુસો જઈ રહ્યા હોય ને તેમાંથી જોઈ એક માણુસ પારો છત્તી હોય ત્યારે દુરથા જોનાનો જોઈ પુરુષ તેમને બતાવવા માટે ‘જુઝો, પેલા છત્તીબાળાઓ જઈ રહ્યા છે’ એવો વાક્યપ્રયોગ કરે છે. આ પ્રમાણે ઓક છત્તીબાળા સાથે સંબંધ હોવાને લીધે તે આપ્યો જામુદુર છત્તીબાળો કહેવાય છે. એને છત્તીન્યાય કહેવામાં આવે છે. એવી જ રીતે અહીં બોક્તા જીવ(આત્મા)ના સંબંધથી ઠીકર(પરમાત્મા)ને પણ બોક્તા કહેવામાં આવ્યો છે.

યः સેતુરીજાનાનામથરં બ્રહ્મ યત્પરમ् ।

અમયં તિતીર્ષતાં પારં નાચિકેતઃશકેમહિ ॥ ૨ ॥

ઇઝાનાનામ्-યશ કરનારાઓને માટે, યઃ સેતુઃ=દુઃખના સંમુદ્રની પાર પહોંચવા માટે જે સેતુ છે; (તમ્) નાચિકેતમ્=તે નાચિકેત અભિને (અને); પરમ् તિતીર્ષતામ્=સંસારસમુદ્રને પાર જવા ઈચ્છા-નારાઓ માટે, યત્ અમયમ्=જે ભયરહિત છે, (તત્) અક્ષરમ્=તે અવિનાશી, પરમ् બ્રહ્મ-પરખણ પુરુષોત્તમને, શકેમહિ=જાળવામાં અને તામું કરવામાં પણ અમે સમર્થ થઈએ. ૨

જે નાચિકેત અભિન્ય યશ કરનારાઓ માટે દુઃખરૂપી સંમુદ્રની પાર પહોંચવામાં યોગ્ય સેતુરૂપ છે તે અભિને તથા સંસાર-સમુદ્રની પાર જવા ઈચ્છાનારાઓ માટે જે ભયરહિત પહું છે અને પરમ આશ્રય છે તે અવિનાશી પરખણ પુરુષોત્તમને જાળવામાં અને પ્રાત્મ કરવામાં અમે શક્તિમાન થઈએ. ૨

ભાષ્ય : દુઃખને પાર કરવાનું સાધન હોવાથી જે નાચિકેત અભિન્ય, વાતમાન અર્થાતું કર્માંશો માટે સેતુ સમાન હોવાને લાઘુ જે સેતુરૂપ છે તે અભિને જાળવામાં અને તેથું અથવા કરવામાં અમે શક્તિમાન થઈએ. વળી જે ભયરહિત છે અને સંસારને તરવાની ઈચ્છાવાળા અભિવેતાઓનો પરમ આશ્રય અવિનાશી ચાાતમાં નામનો અનુ છે તેને જાળવામાં પણ અમે સમર્થ થઈ શકીએ. અર્થાતું કર્મ-પેતાનો આશ્રય અપર અનુ અને અભિવેતાનો આશ્રય પરખણ-આ નેથી જાળવા યોગ્ય છે—ચાા, ચાા વાઙ્મયનો અર્થ છે. ‘કહું પિવન્તૌ’ વગેરે મંત્રથી ચાા જે અને અનુનો ઉલ્લેખ કરવામાં આયો છે. ૨

(આ મંત્રમાં ધમરાને પરમાત્માની તેજને જાળવાની શક્તિ આપવા માટે પ્રાર્થના કરીની એવો જાત્ર દુર્શાંખો છે કે, પરખણ

पुरुषोत्तमने ज्ञानवानुं अने प्राप्त करवानुं सौथा उत्तम अने सरण साधन तेमनी आर्थिना ॥४ छ. २ ॥

६७े ते परम्परा पुरुषोत्तमना परम धाममां ऊर्ध्वां साधनोवालो मनुष्य पहेंची राके छे, आ वात रथ अने रथीना इपुक्की इत्यना करीने समज्ज्ञवप्वामां आवे छे :

**आत्मानःरथिनं विद्धि शरीरःरथमेव तु ।**

**बुद्धिं तु सारथिं विद्धि मनः प्रग्रहमेव च ॥ ३ ॥**

आत्मानम्=( हे नयिकेता ! तमे ) ज्ञात्माने, रथिनम्=रथनो मालिक ( तेमां ऐसीने ज्ञानारो ) विद्धि=ज्ञाणो, तु=अने, शरीरम् एव=शरीरने ॥४, रथम्=रथ ( मानो ), बुद्धि तु=तथा खुद्धिने, सारथिम्=सारथि ( रथने हाँडनारो ), विद्धि=ज्ञाणो, च मनः एव=ने मनने ॥४, प्रग्रहम्=लगाम ( समझे ). ३

हे नयिकेता ! तमे ज्ञात्माने रथी आर्थीत् रथनो स्वाभी ज्ञाणो ; शरीरने ज रथ मानो तथा खुद्धिने सारथि ज्ञाणो अने मनने लगाम समझे. ३

**भाष्य :** ज्ञात्माने अर्थात् कर्मकुण लोगवनारा संसारीने रथी एट्टेके डे रथनो मालिक ज्ञाण, ने शरीरने तो रथ ॥४ समज, क्रेम डे शरीरइपी रथमां जेतरायेला अधिकृप उद्दियसमूहिथी ए शरीरइपा रथने ऐच्चवामां आवे छे. तेम ॥४ निश्चय करवो ए ॥४ जेनुं लक्षणु छे ते खुद्धिने सारथि ज्ञाण; क्रेम डे सारथिइप नेता ॥४ नेमां मुख्य छे ते रथनी समान शरीर खुद्धिइप नेतानी प्रवानतावाणुं छे; कारणु डे देहनां सर्व कार्यो घाणुं करीने खुद्धिनां ॥४ कर्त्तव्यो छे. वज्ञा संकल्प-विकल्पाद्विप मनने प्रग्रह-लगाम समज; क्रेम डे नेवा रीते घाडायो लगामथी वश रहीने चाले छे तेवी ॥४ रीते कर्णु पर्जेरे उक्रियो मनने वश रहीने ॥४ पेताना विषयमां प्रवृत्त थाय छे. ३